



સુરત મહાનગરપાલિકા
સાઉથઝોન-બી(કનકપુર)
આઈ.ટી.આઈ-૨૦૦૫
પ્રો.-એક્ટિવ ડીસ્કલોગર(પી.એ.ડી.)

૨૦૨૩-૨૪

ઓફિસ :—

સાઉથઝોન-બી(કનકપુર)
સચીન, કેન્દ્ર પ્રાથમિક શાળાની સામે,
સચીન નવસારી મેર્ધનરોડ, સુરત.

મુદ્રા નં.૦૧ :— સંસ્થાના કાર્યો અને ફરજો :—

૧.૧ જાહેર તંત્ર ઉદ્દેશ / હેતુ :—

સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને અસરકારક અને ઉત્તરદાયી બનાવવાના સરકારશીના પ્રજાલક્ષી ધ્યેયને મુર્તીમંત સ્વરૂપ આપવા શહેરની પ્રજાને નાગરીક સુવિધાઓ પૂરી પાડવાનો ઉદ્દેશ / હેતુ રહેલો છે.

૧.૨ જાહેર તંત્રનું મિશન / દૂરદૃશીપણું (વિઝન) :—

શહેરમાં વધારે સારો સ્થાનિક સ્વરાજ્ય વહીવટ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યી પ્રજાલક્ષી બાબતોને મહત્વ આપવામાં આવેલાં છે. જાહેર સુખાધિકારો, પાણી, રસ્તા, ગટર, આરોગ્ય, લાઈટ જેવી પ્રાથમિક અને પાયાની સુવિધાઓ તેમજ આધુનિક ટેકનોલોજીથી આંતર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા વધુ સરળ પ્રક્રિયા અપનાવી સમયની બચત સાથે સાથે થાય તેવો ઝડપી અને વ્યવહારૂ ઉકેલ લાવવાની દિશામાં પ્રયાસ કરવાનું મિશન રહેલ છે.

૧.૩ જાહેર તંત્રનો ટુંકો ઈતિહાસ અને રચનાનો સંદર્ભ :—

સુરત શહેર સુધરાઈની સ્થાપના તા. ૧૫/૦૫/૧૮૫૨ થી કરવામાં આવી. તા.૦૧/૧૦/૧૯૬૬ થી મહાનગરપાલિકામાં રૂપાંતર થયુ. અંદાજે ઉર્ફ. ૫૧૫ ચોરસ કિ.મી.નું ક્ષેત્રફળ ધરાવતાં સરૂત મહાનગરપાલિકા કોર્પોરેશનની સને ૨૦૧૧ ની વસ્તી ૪૪,૬૬,૮૨૬ ની છે. ધી બોખે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ-૧૯૪૮ની જોગવાઈ અનુસાર તંત્રની રચના કરવામાં આવેલ છે તેમજ આ અધિનિયમની જોગવાઈઓ મુજબ વહીવટ ચલાવવામાં આવે છે.

૧.૪ જાહેર તંત્રની ફરજો :—

લોકોની રજૂઆતોનો ઝડપી અને ન્યાયપૂર્ણ નિકાલ કરવા અને લોકો સાથે મિત્રતાપૂર્ણ વ્યવહારનો ઉદ્દેશ પાર પડે તે રીતે પારદર્શકતા અને પ્રમાણિકતાભર્યો વહીવટ ચલાવવાની ફરજ રહેલી છે.

૧.૫ જાહેર તંત્રની મુખ્ય પ્રવૃત્તિઓ / કાર્યો :—

મહાનગરપાલિકા ધ્વારા ધી જી. પી. એમ. સી. એકટ (૧૯૪૮)ની કલમ-૬૩ મુજબ કરવામાં આવતી ફરજિયાત પ્રવૃત્તિઓ નીચે મુજબ છે.

(૧) શહેરના તમામ રસ્તાઓ ઉપરથી કચરો સાફ કરાવવો,

(૨) સુઅેજ અને દુર્ગંધ મારતો પદાર્થ, કચરો, પુંજી એકઠા કરવા અને લઈ જવા

(૩) મોરીઓ અને ગટરકામ તથા સાર્વજનિક શૌચાલયો સાફ કરાવવા અને નિભાવવા અંગે

(૪) આગ ઓલવવા અને આગ સામે જીદળી અને મિલકતનું રક્ષણ કરવું.

(૫) સ્પર્શ જન્ય રોગો સામે પગલાં લવો

(૬) સાર્વજનિક રસ્તાઓ ઉપર દિવાબતીની વ્યવસ્થા

(૭) મ્યુ. ઓફિસ અને મ્યુનિ. ને પ્રાપ્ત થયેલા સ્મારકો, ખલ્લી જગ્યાઓ નિભાવવા

- (૮) કોર્પોરશેનને પ્રાપ્ત થયેલા રસ્તાઓ અને સાર્વજનિક જગ્યાઓના નામ આપવા
- (૯) મડાના નિકાલ માટેની જગ્યાઓ નિભાવવી અને નિયમત ન કરવા અંગે
- (૧૦) સાર્વજનિક માર્કેટો અને કટલખાના બાંધવા અને સંપાદન કરવા અને નિભાવવા
- (૧૧) થોર પુરવાના ડબ્બા બાંધવા, સંપાદન કરવા અને નિભાવવા
- (૧૨) શીતળાની રસી ટાકવા
- (૧૩) પ્રાથમિક શિક્ષણ માટે શાળાઓ નિભાવવી અને તે માટે જગ્યાની સગવડ કરી આપવી
- (૧૪) આરોગ્યને હાનિ કરે તેવા લતાઓ સુધારવા અને ઉપદ્રવકારક ઝડ-પાલો કાઢી નાખવા
- (૧૫) જન્મ-મૃત્યુની નોંધણી
- (૧૬) સાર્વજનિક રસ્તાઓ, પુલો, પેટા માર્ગો નિભાવવા અને બનાવવા
- (૧૭) સાર્વજનિક રસ્તાઓ, પુલો પરના હરકત અને બહાર નીકળતા કોઈપણ બાંધકામો કઢાવી નાખવા
- (૧૮) ભયંકર રોગો થતા અટકાવવા અને તેનો ફેલાવો રોકવો
- (૧૯) જોખમકારક ઈમારતો અને જગ્યાઓ સુરક્ષિત કરવી અથવા કાઢી નાખવી
- (૨૦) દુકાણ અને અછિતના વખતે રાહતની જોગવાઈ કરવી.
- (૨૧) રેવન્યુ આવકના ૧૦% સુધી સ્લેમ વિસ્તારોમાં ખર્ચ કરવા અંગે ,

૧.૬ ઝોન કચેરી ધ્વારા આપવામાં આવતી સેવાઓની યાદી અને તેનું સંક્ષિપ્ત વિવરણ :—

(૧) પાણી પુરવઠો :—

તાપી નદી તથા તેના સબસોઈલ બેઝીનમાં બોર / કુવામાંથી પંખીગ ધ્વારા પાણી પુરવઠો મેળવી યોગ્ય શુદ્ધિકરણ પ્રક્રિયાબાદ વિવિધ ઝોનમાં ઈ.એસ.આર. મારફતે વિતરણ ધ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે તેમજ તેને લાગત ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવે છે.

(૨) સફાઈ સેવા :—

સમગ્ર શહેરમાં વપરાશી ગંદા પાણીના નિકાલ માટે ભુગાર્ભ ગટર યોજના અમલમાં મુકાયેલ છે. સાથે સાથે વોર્ડમાં ઉત્પન્ન થતો કચરો ખાતાના વાહનો તથા ભાડાના/કોન્ટ્રાક્ટનાં પ્રાઈવેટ વાહનો ધ્વારા નિકાલ કરવામાં આવે છે. તેમાં આધુનિક પદ્ધતિથી હાઈડ્રોલીક કન્ટેનરો, કેપીયરો ધ્વારા જુદા જુદા વોર્ડમાં અને સ્લેમ વિસ્તારોમાં ઉત્પન્ન થતો કચરો નિકાલ કરવામાં આવે છે. ઉપરાંત, મૃત પશુઓનો નિકાલ, મચ્છી તેમજ મટન માર્કેટમાંથી નીકળતા વેસ્ટનો નિકાલ, સેપ્ટીક ટેક સફાઈની કામગીરી કરવામાં આવે છે.

(૩) દીવાખતી સેવા (લાઈટ શાખા):-

રોશની વિભાગ ધ્વારા સરૂત શહેરના સમગ્ર વિસ્તારોના જાહેર રસ્તા તેમજ શહેરના સુશોભન માટે તૈયાર કરવામાં આવેલ કુવારાઓ બગીચાઓ અને મ્યુ.હસ્તકના બિલ્ડીંગ તેમજ શાળાઓમાં લાઈટીંગ વ્યવસ્થા કરવામાં આવે છે .

(૪) સ્ક્રિવિલ શાખા :-

(રસ્તાઓની સુવિધા) અન્વયે શહેરમાં કાચા રસ્તાઓ, મેટલ રોડ, પેવર રોડ, સિમેન્ટ રોડ વિગેરે જુદા જુદા રસ્તાઓ તૈયાર કરી નિભાવવામાં આવે છે. નવ ઈચ્છથી નાની તેમજ નવ ઈચ્છથી મોટી ઓપન ગટર તેમજ સ્ટોર્મ વોટર ડ્રેઇન તૈયાર કરવામાં આવે છે.

(૫) સ્લઘ શાખા :-

ધી. બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૮ના સેક્શન-૬૩(૨)-ની જોગવાઈ મુજબ તથા રાજ્ય સરકાર/ કેન્દ્ર સરકારની ગ્રાંટ/લોન ઉપલબ્ધ થયેથી પછાત વિસ્તારોની સુધારણા માટેની કામગીરી તથા મ્યુ.કોર્પો. હસ્તકની સ્લમની જમીનનો વિકાસ/સુધારણા કરવા એ સામાન્ય ઉદ્દેશ રહેલ છે. જેમાં આર્થિક અને સામાજિક રીતે પછાત તેમજ ઘરવિહોષાં લોકો માટે રાજ્ય સરકારની પોલીસી અનુસાર આવાસ યોજના અમલમાં મુકાય છે.

(૬) જમીન-મિલકત વિભાગ :-

ભયજનક બાંધકામ જો મિલકતધારક દુર ન કરે તો મિલકતધારકના ખર્ચે, જોખમે દુર કરવાની કામગીરી કરવામાં આવે છે. જુદા જુદા શોપીંગ સેન્ટર્સના ભાડા વસુલ કરવાની કામગીરી, મ્યુ.ટેનામેન્ટનાં હપ્તા વસુલાત કરવાની કામગીરી મહાનગરપાલિકાનાં જમીનો/ હોલ/ પાર્ટી પ્લોટ કામચલાઉ ભાડે આપવાની તથા તેનું ભાડું વસુલ કરવાની કામગીરી તથા જમીનમિલકતને લગતી આનુસાંગિક તમામ કામગીરી.

(૭) શહેર વિકાસ શાખા / ટાઉન પ્લાનીંગ શાખા :-

વિકાસ નક્શાનો અમલીકરણ તથા જાહેર હેતુના અનામત પ્લોટોને લાગત કાર્યવાહી તેમજ રસ્તાઓનું દખાણ હટાવવા બાબત. નવા લે-આઉટ પ્લાન, નવી બાંધકામ વિકાસ પરવાનગી, પ્લીન્થ સર્ટીફિકેટ, વપરાશ પરવાનગી, નગરરચના યોજનાનુંઅમલીકરણ, સબપ્લોટીંગ, એમાલગમેશનની મંજૂરી નિયમોનુંસાર આપવાની કામગીરી કરવામાં આવે છે.

(૮) આકારણી અને સીધાવેરા વિભાગ :-

ધી. બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૮ની કલમ-૧૨૭ અન્વયે ઝોન વિસ્તારની મિલકતો ઉપર વખતો-વખત નક્કી કરાયેલા દરથી મિલકતવેરો વસલુવામાં આવે છે તેમજ પ્રોપરીમાં નામ ટ્રાન્સફર, દર ચાર વર્ષ રીવીઝન કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.

(૯) ગુમાસ્તા ધારા / વ્યવસાય વેરા વિભાગ :—

ગુજરાત દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ – ૨૦૧૮ માં જણાવ્યા મુજબની તમામ ફરજો બજાવવી જેવી કે, સંસ્થાનીનોંધણી થયેલ છે કે કેમ ? તેમજ સંસ્થામાં કામ કરતાં કર્મચારીઓનાં હાજરી પત્રક, પગાર પત્રક વિગેરેની તપાસ તથા ધારાબંગની નામદાર મ્યુનિ.કોર્ટ માં ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરવી.

ગુજરાતના દુકાનો અને સંસ્થાઓના અધિનિયમોનાં નિયમની જોગવાઈઓનું અમલીકરણ કરાવવું. કર્મચારી જીવન વીમા અધિનિયમ ૧૯૮૦ની જોગવાઈઓનું પાલન કરાવવું. ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ ૧૯૭૬ અંતર્ગત લાગુ પડતી સંસ્થાઓ પાસેથી લાગુપડતા વ્યવસાય વેરોની વસૂલાત કરવી તેમજ કર્મચારીઓના વ્યવસાય વેરા ફાળાની વસૂલાત કરવી. નોંધણી પ્રમાણપત્ર રીન્યુ કરવાની કામગીરી કરવી.

(૧૦) પુર્વ પ્રાથમિક શિક્ષણ / બાલમંદિર, નગર પ્રાથમિક શિક્ષણ તેમજ ઉચ્ચતર શિક્ષણ :—

મહાનગરપાલિકા હસ્તક દક્ષિણ ઝોનમાં ૦૮ આંગણવાડીનો વહીવટ ચલાવવામાં આવે છે તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત ઉર પ્રાથમિક શાળાઓનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ધારા વહીવટ કરવામાં આવે છે. સાઉથ ઝોન (ઉધના) વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત ૨(બે) સુમન શાળાઓ આવેલ છે. જેનો વહીવટ સુમન શાળા સેલ ધારા કરવામાં આવે છે.

(૧૧) મોટર વાહન શાખા :—

જાહેર પદ્ધતીકને ટેન્કર ધ્વારા જરૂરીયાત મુજબ ભાડું નક્કી કરીને પાણી પહોંચાડવું.

(૧૨) ગાર્ડન શાખા :—

મહાનગરપાલિકાના દરેક બાગ—બગીચાની સારસંભાળ વૃક્ષો વાવવા તેમજ તેમની સંભાળ રાખવી જાહેર જનતાની સુવિધા તેમજ બાળકોના આનંદ પ્રમોદ માટે ગાર્ડન વિ. સંચાલન

(૧૩) યુ.સી.ડી. શાખા :—

શહેરી ગરીબી રેખા હેઠળના કુટુંબોને રાષ્ટ્રીય સહાય, વિધવા પેન્શન યોજના, પછાત વિસ્તારમાં કોમ્યુનીટીના જુદા જુદા વર્ગો જેવા કે સિવણ કલાસ, મહેંદી, બ્યુટીપાર્લર, વાનગી હરીકાઈ વિ.ના પ્રોગ્રામો કરવા તેમજ આરોગ્યને લાગત પ્રોગ્રામ.

(૧૪) આઈ.સી.ડી.એસ. શાખા :—

બાલવિકાસ યોજના અંતર્ગતની સર્વે કામગીરી તેમજ બાળકોના આરોગ્ય તેમજ માતાની તંદુરસ્તી અંગે બાલવિકાસમાં કાળજી લેવામાં આવે છે.

(૧૫) આરોગ્ય વિભાગ :—

પોલિયો, જાહેર આરોગ્ય, દવાખાના ધ્વારા આરોગ્ય, સાચવણી, જાહેરમાં વેચાણ થતા ખાદ્યપદાર્થોથી ફેલાતા રોગચાળા સામે યોગ્ય સારવાર તેમજ અરજદાર નાગરીક અથવા તો હોસ્પિટલો તરફથી જન્મ અથવા મરણની નોંધ નિયત ઝોર્મમાં રજુ થયે (જરૂરી ફી સાથે) નોંધણી કરવામાં આવે છે અને જન્મ-મરણ સટીઝીકેટ ઈસ્યુ કરવામાં આવે છે .

(૧૬) વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ :—

નાયબ આરોગ્ય અધિકારીના નિયંત્રણ હેઠળ આસી. જંતુનાશક અધિકારી કામગીરી કરે છે. તેમના હાથ નીચે ફાઈલેરિયા નિરીક્ષક ત્રણ (ત્રણ આરોગ્ય વોર્ડ દીઠ એક ફાઈલેરિયા નિરીક્ષક) દરેક ફાઈલેરિયા નિરીક્ષકના હાથ નીચે બે મદદનીશ ફાઈલેરિયા નિરીક્ષક તથા તેમના હાથ નીચે પ્રાઇમરી હેલ્થ વર્કર ફરજ બજાવે છે. સામાન્યતઃ ૧૦,૦૦૦ ની વસ્તીએ એક પ્રાઇમરી હેલ્થ વર્કર સર્વેલાન્સની કામગીરી કરશે.

(૧૭) અભિનશમન સેવા (ફાયર બ્લિગેડ):—

મહાનગરપાલિકા હસ્તકનાં કુલ :— ૧૩ (તેર) ફાયર સ્ટેશન છે. જેનાં દ્વારા શહેરી વિસ્તારમાં આકસ્મિક ઘટના દરમ્યાન બચાવની કામગીરી કરવામાં આવે છે. સાઉથ ઝોનમાં ભેસ્ટાન ખાતે ફાયર સ્ટેશન આવેલ છે.

(૧૮) કાયદા ખાતુ / એપેલેટ વિભાગ :—

સમગ્ર ઝોન વિસ્તારની મિલકતો પર આકારણી ખાતા ધ્વારા લેવામાં આવતા કરો સામે કરપાત્ર વ્યક્તિ ધ્વારા જોકોઈ વાંધા અરજી દાખલ કરવામાં આવે તો તેનો કાયદાકીય રાહે નિકાલ કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોનને લાગત કોર્ટ મેટરો અંગે ઝોનનાં લાગત ખાતા સાથે સંકલનમાં રહી કાયદાકીય માર્ગદર્શન, અભિપ્રાય આપવાની કામગીરી કરવામાં આવે છે.

૧.૭ જાહેર તંત્રની અસરકારકતા અને કાર્યક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષાઓ :—

સુરત મહાનગરપાલિકા ધ્વારા થતા કામો જેવા કે સફાઈ વ્યવસ્થા, લાઈટીંગ વ્યવસ્થા, પાણી વિતરણ વ્યવસ્થા, રાહતકાર્યો, કુદરતી આફિનો વિ. માટે લોકો દરેક કાર્યને પોતાના હિતનું સમજે અને શહેર સ્વચ્છ અને સુશોભિત રહે તેવી લાગણીથી સહકાર આપે તેવી લોકો પાસે અપેક્ષા રાખે છે .

૧.૮ લોક સહયોગ મેળવવા માટેની ગોડવણ અને પદ્ધતિઓ :—

પાણી વેરો, મકાનવેરો, અન્ય વેરાઓ, ચાર્જીસ, ફી જે લાગુ પડે છે તે સમયસર ભરપાઈ કરવામાં આવે તો મહાનગરપાલિકા વિકાસના કાર્યોનું આયોજન કરી શકે તેમજ જાહેર જનતા દ્વારા શહેરમાં લોક ભાગીદારીથી વિકાસનાં કામો કરવા સહયોગ મેળવવો જોઈએ તેમાં જાહેર સંસ્થાઓ, એસોસીએશનો, કલબો તથા સેવા ટ્રસ્ટો જાહેર જનતા ધ્વારા શહેરમાં લોકભાગીદારીથી વિકાસના કામો કરવા સહયોગ આપવો જોઈએ.

૧.૮ સેવા આપવાના દેખરેખ નિયંત્રણ અને જાહેર ફરિયાદ નિવારણ માટે ઉપલબ્ધ તંત્ર : -

સુરત મહાનગરપાલિકા ધ્વારા સેવા આપવા તથા દેખરેખ અને નિયંત્રણ તથા જાહેર ફરિયાદ નિવારણ માટે સાઉથ ઝોન -બી (કનકપુર) કચેરી, નાગરિક સુવિધા કેન્દ્રો, આરોગ્ય વોર્ડ ઓફિસો, વી.બી.ડી.સી. યુનિટો ખાતે તાંત્રિક વ્યવસ્થા કરવામાં આવી છે.

૧.૧૦ કચેરીનો સમય

કચેરી કામકાજનો સમય સવારે ૧૦:૩૦ થી બપોરે ૨:૩૦ અને બપોરે ૩:૦૦ થી સાંજે ૬:૧૦

વોર્ડ ઓફિસ:- સવારે ૭:૦૦ થી ૧૧:૦૦, બપોરે ૨:૩૦ થી સાંજે ૫:૩૦

ઇજનેરી ટેપો :- સવારે ૮:૩૦ થી બપોરે ૧૨:૩૦, બપોરે ૨:૧૦ થી સાંજે ૬:૧૦

વી.બી.ડી.સી. યુનિટ:- સવારે ૮:૦૦ થી સાંજે ૪:૦૦

ફીલ્ડ ડયુટીનો સ્ટાફ સવારે ૮:૩૦ થી બપોરે ૧૨:૩૦ બપોરે ૨:૧૦ થી સાંજે ૬:૧૦

સાઉથઝોન(ઉધના)બી—કનકપુર

સુરત મહાનગરપાલિકા

હોદ્દો	જોબ ચાર્ટ/કામગીરીની વિગત
ડે.મ્યુનિ.કમિશનરશ્રી	— સાઉથઝોન—બી (કનકપુર) ડે.કમિશનરશ્રી તરીકે સમગ્ર જોનને નેતૃત્વ પુર પાડવું. તેમજ તાબા હેઠળના અધિકારી / કર્મચારીઓ પાસેથી સાઉથઝોન—બી (કનકપુર)ને લગતી તમામ પ્રકારની કામગીરીની દેખરેખ રાખી માર્ગદર્શન પુરું પાડવું. જોનના ડે.કમિશનર તરીકે તેઓને વહીવટી સત્તાઓ પ્રદાન કરવામાં આવી છે.
આસીસ્ટન્ટ કમિશનરશ્રી	— સાઉથઝોન—બી(કનકપુર)ના વહીવટી વિભાગના વડા તરીકે ફરજ બજાવવી, જેમાં સાઉથઝોન—બી (કનકપુર) જોનના ઈજનેરી વિભાગ સિવાયના તમામ વિભાગો જેવા કે, આકારણી અને વેરા વસુલાત વિભાગ, ગુમાસ્તાધારા અને વ્યવસાયવેરા વિભાગ, મહકે મ વિભાગ, હિસાબી વિભાગ, પ્રોફ્શન નલ કાયદા / લિગલ વિભાગની તમામ કામગીરી ઉપર દેખરેખ રાખવી અને તાબા હેઠળના સ્ટાફ માર્કફ્ટ કામગીરી કરાવવી. જમીન—મિલ્કટ વિભાગની નાણાંકીય વસુલાત સંબંધીત કામગીરી. — આર.ટી.આઈ.એક્ટ — ૨૦૦૫ હેઠળ ઉપરોક્ત વિભાગો પરત્યેના અપીલ અધિકારી તરીકેની સત્તા પ્રદાન કરવામાં આવેલ છે તેઓના કાર્યક્ષેત્ર હેઠળના વિભાગોના અપીલ અધિકારી તરીકેની કામગીરી. — પુર, મહામારી, ભુક્ખ, વાવાજોડા કે અન્ય કુદરતી આફતો વખતે કમિ.શ્રી ધ્વારા સોપવામાં આવતી વધારાની કામગીરી.
કાર્યપાલક ઈજનેરશ્રી	— સમગ્ર સાઉથ ઝોન—બી ના ઈજનેરી વિભાગના વડા તરીકેની ફરજ બજાવવી, સમગ્ર ઝોન વિસ્તારમાં ઈજનેરી વિભાગને લગતી તમામ પ્રકારની કામગીરી ઉપર દેખરેખ રાખવી અને તાબા હેઠળના સ્ટાફ માર્કફ્ટ ઈજનેરી વિભાગની કામગીરી કરાવવી. — આર.ટી.આઈ.એક્ટ—૨૦૦૫ હેઠળ અપીલ અધિકારી તરીકેની સત્તા પ્રદાન કરવામાં આવેલ છે તેઓના કાર્યક્ષેત્ર હેઠળના વિભાગોના અપીલ અધિકારી તરીકેની કામગીરી. — પુર કે અન્ય કુદરતી આફતો વખતે સોપવામાં આવતી વધારાની કામગીરી.
ડે.ઇજનેર / ડે.ટાઉન પ્લાનર	— સબ ઝોન વિસ્તારમાં કાર્યક્ષેત્ર હેઠળનાં તમામ આસી./ જુની.ઇજનેરોને સોપવામાં આવેલ વિવિધ ખાતાઓને લગતી કામગીરીનું સુપરવિઝન તેમજ સંકલનની કામગીરી. — વધુમાં કાર્યપાલક ઈજનેરશ્રી તરફથી જે તે સમય સંજોગો અને પરિસ્થિતિને અનુરૂપ સોપવામાં આવતી કામગીરી, ભુક્ખ, ભારે વરસાદ જેવી આફતોનાં પ્રસંગે ડીજાસ્ટર મેનેજમેન્ટનો અમલ અને રાહતને લગતી કામો — નવરાત્રીને લગતી જાહેર કામો રેલ રાહતને લગતી તમામ કામો — ટેકનીકલ ખાતાના કર્મચારીઓનું અઠવાડિક યેકીગની કામગીરી, મહિનામાં એકવાર આરોગ્યખાતામાં જુદા જુદા ઝોનમાં રાત્રિ સ્કેપ્ટોગ/ બ્રશીગની કામગીરીનું સુપરવિઝન, — પોતાના હાથ નીચેનાં કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ. — જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજ
આસી.ટાઉન પ્લાનર —	— સમગ્ર ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ ટી.પી. સ્કીમોના આઈ.સી.ના નાણાની રીકવરીને લગતી તમામ કામગીરી. — સમગ્ર ઝોન વિસ્તારમાં જાહેરાતના બોર્ડ /હોર્ડિંગને લગતી તમામ કામગીરી. — સમગ્ર ઝોન વિસ્તારમાં ટેલીકોમ્યુનીકેશન ટાવરને લગતી તમામ કામગીરી. — સમગ્ર ઝોન વિસ્તારમાં જુદા જુદા રસ્તાઓ ચોક વગેરેનાં નામકરણની તમામ કામગીરી.
રસ્તા વિભાગ	
આસી./ જુની.ઇજનેર	— નવા રસ્તા મેટલ ગ્રાંટીંગ, કારપેટ / રીકારપેટ કરવાના કામનાં અંદાજ તૈયાર કરવા, ટેન્ડર કામગીરી તથા સ્થળ પર રસ્તા બનાવવાનાં કામનું સુપરવિઝન. — હયાત રસ્તાનાં મરામત / નિભાવની કામગીરી. — નવા ફુટપાથ બનાવવાનાં અંદાજ / ટેન્ડરની કામગીરી તથા સુપરવિઝન. — રોડ મટીરીયલ્સ સપ્લાયની કામગીરી — રસ્તા સંબંધી આવેલ ફરિયાદનાં તુમારનાં નિકાલની કામગીરી

	<ul style="list-style-type: none"> - થયેલ કામોનાં બીલ બનાવવા, ઓડિટ ઓફિશનનાં નિકાલની કામગીરી - વોર્ડ સમિતિને લગતી તમામ કામગીરી - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી/કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિજન અને સંકલનની તમામ કામગીરી - હાજરી નિયંત્રણ. - રસ્તા વિભાગનાં મદદનીશ માહિતી અધિકારી તરીકેની ફરજ
પાણી વિભાગ	
આસી./ જુની.ઈજનેર	<ul style="list-style-type: none"> - ઝોન વિસ્તારનાં સોસાયટી, ગુંપડપટ્ટી વિસ્તારમાં પાણીની નાળિકા નાંખવાનું કામ. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિજન - હાજરી નિયંત્રણ. - પાણી વિભાગનાં મદદનીશ માહિતી અધિકારી તરીકેની ફરજ
હાઉસીંગ વિભાગ	
આસી./ જુની.ઈજનેર/ સુપરવાઈઝર	<ul style="list-style-type: none"> - ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની મિલકતોનાં બાંધકામ, અંદાજ બનાવવાની કામગીરી, ટેન્ડરની કામગીરી, ચાલુ કામો પર દેખરેખ, સુરત મહાનગરપાલિકાની માલિકીની મિલકતોની નિભાવની કામગીરી - કાગળોનાં પત્રવ્યવહારની કામગીરી - વિવિધ પ્રસંગોની ઉજવણી/આયોજીત પ્રસંગે જરૂરી કામચલાઉ વ્યવસ્થા કરવાની કામગીરી - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ/ સુપરવિજન - હાજરી નિયંત્રણ. - હાઉસીંગ વિભાગનાં મદદનીશ માહિતી અધિકારી તરીકેની ફરજ
જમીન મિલકત વિભાગ	
આસી.ઈજનેર	<ul style="list-style-type: none"> - ઓડિટ વાંધાઓનો નિકાલ, સીક્યોરીટી ડિપોઝિટ છુટી કરવા સુધીની તમામ કાર્યવાહી કરવાનું - મહાનગરપાલિકાની જમીન/મિલકત/ પે એન્ડ પાર્ક, કામચલાઉ ભાડે આપવાની તથા તેનું ભાડું વસુલ કરવાની કામગીરી તથા જમીનમિલકતને લગતી આનુસારિક તમામ કામગીરી. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ/ સુપરવિજન - હાજરી નિયંત્રણ.
કલાર્ક -	<ul style="list-style-type: none"> - જુદા જુદા શોપીંગ સેન્ટરના કણની સૌંપણી / રદ કરવા / ફરી ફાળવણી કરવી / ભાડા વસુલ કરવાની તેમજ તેને લગતી આનુસારિક તમામ કામગીરી - ઈ.ડબલ્યુ.એસ. આવાસનાં કણની સૌંપણી/ રદ કરવા/ફરી ફાળવણી/ ડપ્ટા વસુલાત કરવાની કામગીરી
ડ્રેનેજ વિભાગ /સ્ટ્રોમ ડ્રેનેજ વિભાગ	
આસી./ જુની.ઈજનેર/ સુપરવાઈઝર	<ul style="list-style-type: none"> - સમગ્ર ઝોન વિસ્તારનાં ડ્રેનેજ/સ્ટ્રોમ ડ્રેઇન લાઈનોનાં અંદાજો બનાવવા - ટેન્ડરો મંગાવવા, મંજૂર કરાવવા, કોન્ટ્રોક્ટ સૌંપી સ્થળ કામગીરીનું સુપરવિજન, માપણી, રનીંગ તથા ફાઇનલ બીલો બનાવવા, સમગ્ર ઝોન વિસ્તારમાં મિલકતોનાં ડ્રેનેજ કનેક્શનની મંજૂરી આપવી, - ડ્રેનેજ/સ્ટ્રોમ ડ્રેનેજને લાગત ઓડિટ વાંધાઓનો નિકાલ, સીક્યોરીટી ડિપોઝિટ છુટી કરવા સુધીની તમામ કાર્યવાહી કરવાનું તમામ પ્રકારની માહિતી આપવાનું, આ તમામ સ્ટોર્મ તથા સુઅર ડ્રેઇન લાઈનોનાં મરામત નિભાવની કામગીરી જેવી કે રીપેરીંગ, લાઈનોની સાફ્ટ-સફાઈ (ડિસલ્વીંગ), રીવર ફ્લાડ ગેટોનાં ઓપરેશન મેઇનન્ટેનસની કામગીરી, પાણીનાં ભરવા/ લાઈનો ચોકઅપ થવાનાં પ્રસંગે ડીવોટરીંગ પંપો ચલાવવાની તથા નિભાવણીની કામગીરી, જાળીયા તથા મેનહોલ ખરીદવા, સાફ કરવા વિગેરે તમામ કામગીરી.

	<ul style="list-style-type: none"> - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી/કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન - હાજરી નિયંત્રણ. - ટ્રેનેજ/સ્ટ્રોમ્ ટ્રેનેજ વિભાગનાં મદદનીશ માહિતી અધિકારી તરીકેની ફરજ
લાઈટ વિભાગ	
આસી. ઈજનેર(ઇલે.)/ જુની. ઈજનેર(ઇલે.)	<ul style="list-style-type: none"> - સમગ્ર જોન વિસ્તારની સ્ટ્રીટ લાઈટોની મરામત, નિભાવની કામગીરીનું દેખરેખ તથા નવા સ્ટ્રીટ લાઈટ પોલ ઉભા કરવાના કામે અંદાજો રજુ કરાવવા - કોન્ટ્રાક્ટથી કામ સૌંપી સ્થળ ઉપર સુપરવિઝન તથા એનજી બીલોની ચૂકવણી તથા ભ્યુ. મિલ્કતોનાં વિદ્યુતને લાગત મરામત નિભાવ સહિતની કામગીરી. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ/સુપરવિઝન - હાજરી નિયંત્રણ. - લાઈટ ખાતાનાં મદદનીશ માહિતી અધિકારી તરીકેની ફરજ
શહેર વિકાસ વિભાગ આસી./ જુની. ઈજનેર/ સુપરવાઈઝર	<ul style="list-style-type: none"> - સાઉથ જોન વિસ્તારમાં વિકાસ પરવાનગીની ફાઈલો મંજુર કરવી. - સમયાંતરે મુખ્ય કચેરી, સરકારી તથા અન્ય કચેરીએથી માંગવામાં આવતી માહિતી આપવી/ સંકલન કરવું, - ગેરકાયદેસર બાંધકામને નોટીસ આપી, તોડવા, - મંજુર પ્લાન મુજબ—માર્ગદર્શન, - ટેમ્પરરી સ્ટ્રક્ચરો – (પ્રદર્શન, કથા, ડાયરો, મેળા, ફટાકડા, જાદુગાર, ગણપતિ, નવરાત્રી આયોજન, લેબર કેમ્પ/શીખીર વિગેર)ને મંજુરી આપવી, - ભયજનક /બિસ્માર મિલ્કતોને આઈડેન્ટીફાઈ કરી, નોટીસ આપી, ઉતારી લેવાની કામગીરી, - B.U.C. આપવાની કામગીરી, - ટી.પી. સ્કીમનું અમલીકરણ - રોડ, રસ્તાનું ડીમાર્કેશન - ટાઉન પ્લાનીગ એકટ મુજબ નોટીસ આપી રસ્તાની જગ્યાને કબજો મેળવવો, - રીજર્વેશન પ્લોટની સાચવણી, ડીમાર્કેશન, બોર્ડ મારવા, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરવી, - ડેવલપમેન્ટનાં રીજર્વેશન પ્લોટમાં દબાણ / ગેરકાયદેસર બાંધકામ ન થાય તેનાં પગલાં લેવા, - ઇમ્પેક્ટ ફી ની વસુલાત, C.O.R., ની કામગીરી - લારી—ગલ્લા, દબાણ દૂર કરવા, - જાહેર જનતાની વિવિધ મિલ્કતોની ટાઉન પ્લાનીગ તથા શહેર વિકાસને લગતા મુદ્દાઓની પુછતાછનો નિકાલ, પ્રિલીમનરી / ફાયનલ ટી.પી. સ્કીમનાં રીજર્વ પ્લોટમાં દબાણકર્તાઓની વ્યક્તિગત નોટીસ તૈયાર કરી, રીજર્વ પ્લોટનાં કબજા મેળવવાની કાર્યવાહી. - પોલીસ ચોડી, પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક, પીકઅપ સ્ટેન્ડનાં લોકેશન— ડીમાર્કેટ કરવા. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન - હાજરી નિયંત્રણ. - શહેર વિકાસ ખાતાનાં મદદનીશ માહિતી અધિકારી તરીકેની ફરજ
દબાણ વિભાગ	
સુપરવાઈઝર/ટેકનિકલ આસી.	<ul style="list-style-type: none"> - જાહેર રસ્તા પરનાં દબાણ દૂર કરવાની તથા શહેર વિકાસ ખાતાનાં માર્ગદર્શન હેઠળ ગેરકાયદસેર બાંધકામ દૂર કરવાની કામગીરી તથા અધિકારીશ્રીઓની સુચનાઓનું વખતોવખત પાલન કરવાની કામગીરી. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ.
આરોગ્ય વિભાગ	
નાયબ આરોગ્ય અધિકારી	<ul style="list-style-type: none"> - સમગ્ર જોનમાં આરોગ્યલક્ષી કામગીરીઓ અંગે તમામ વોર્ડ કચેરી તથા વાહક જનિત રોગ નિયંત્રણ યુનિટની કામગીરીનું સુપરવિઝન અને વહીવટી કામગીરી.

	<ul style="list-style-type: none"> - પોતાના હાથ નીચેના કર્મચારી/કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ. - આરોગ્યલક્ષી બાબતોને લાગત ટેકનીકલ કામગીરીઓનું સંકલન - સાફ સફાઈની કામગીરી - જંતુનાશક દવાઓનો છંટકાવ - ઘન કચરાનું એકન્ટ્રિકરણ, પરિવહન અને આખરી નિકાલ - મરેલા જાનવરો(નાના અને મોટા)નો નિકાલ - ધી બી.પી.એમ.સી. હેઠળનાં લાઈસન્સનાં રીન્યુઅલની કામગીરી - ગલી—ટ્રેપ ચોકીંગ દુર કરવાની કામગીરી - ખાળુંબા સફાઈ, જાહેર જાજરુ સફાઈ, ગલી સફાઈ, વપરાશી કૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાના કલોરીન ટેસ્ટ, ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા - ખાણી પીણીની હોટેલ, લારી ગલ્વા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી જાહેર જાજરુ / પિશાબદાનીની સફાઈની કામગીરી - જાહેર મનોરંજનનાં સ્થળો જેવા કે સિનેમા, નાટ્યગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ - રોગચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીદ જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી. - ઈ—ગવર્નન્સ, કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળનાં અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી. - નાગરીક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી ફરિયાદોની ૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા
ચીફ એસ.આઈ. —	<ul style="list-style-type: none"> - સમગ્ર ઝોન વિસ્તારમાં આરોગ્યલક્ષી તમામ કામગીરી કરાવવાની. - પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન - હાજરી નિયંત્રણ. - સાફ સફાઈની કામગીરી - જંતુનાશક દવાઓનો છંટકાવ - ઘન કચરાનું એકન્ટ્રિકરણ, પરિવહન અને આખરી નિકાલ - મરેલા જાનવરો (નાના અને મોટા)નો નિકાલ — ધી બી.પી.એમ.સી. હેઠળનાં લાઈસન્સનાં રીન્યુઅલની કામગીરી - ગલી—ટ્રેપ ચોકીંગ દુર કરવાની કામગીરી - ખાળુંબા સફાઈ, જાહેર જાજરુ સફાઈ, ગલી સફાઈ, વપરાશી કૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાના કલોરીન ટેસ્ટ, ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા - ખાણી પીણીની હોટેલ, લારી ગલ્વા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી જાહેર જાજરુ / પિશાબદાનીની સફાઈની કામગીરી - જાહેર મનોરંજનનાં સ્થળો જેવા કે સિનેમા, નાટ્યગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ - રોગચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીદ જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી. - ઈ—ગવર્નન્સ, કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળનાં અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી. - નાગરીક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી ફરિયાદોની ૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા

	<ul style="list-style-type: none"> નાગરિકોને મહાનગરપાલિકાના સંચાલન માટેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકે તે માટે નાગરિક અધિકારપત્રનાં આરોગ્ય વિભાગને લાગત વિગતો ઉપલબ્ધ રાખવી. દરેક વોર્ડ વાઈજ રોજેરોજ પાણીનાં નમુના બેકોરીયોલોજીકલ / કેમીકલ ટેસ્ટ માટે મેળવી તેનું પૃથ્વકરણ કરી ગંદા પાણીની ફરિયાદનાં અનુસંધાનમાં આરોગ્ય વિષય કામગીરી.
આરોગ્ય નિરીક્ષક –	<ul style="list-style-type: none"> આરોગ્યલક્ષી તમામ કામગીરી કરાવવાની તથા યુનીટ ખાતેનાં કર્મચારીઓ પાસે વાહકજનિત રોગ નિયંત્રણ માટેની તમામ પ્રકારની કામગીરી કરાવવાની, રાત્રિ સ્કેપીંગ / બ્રશીંગ કામગીરીનું સુપરવિઝન તેમજ વહીવટી કામગીરી પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી/કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપરવિઝન હાજરી નિયંત્રણ સાફ્ફ સફાઈની કામગીરી જંતુનાશક દવાઓનો છંટકાવ ઘન કચરાનું એક્ટિવિકરણ, પરિવહન અને આખરી નિકાલ, મરેલા જાનવરો(નાના અને મોટા) નો નિકાલ દી. બી. પી. એમ. સી. હેઠળનાં લાઈસન્સનાં રીન્યુઅલની કામગીરી ગલી-ટ્રેપ ચોકીંગ દુર કરવાની કામગીરી ખાળકુવા સફાઈ, જાહેર જાજરૂ સફાઈ, ગલી સફાઈ વપરાશી કૂવાનું કલોરિનેશન અને પાણીના નમુનાનાં કલોરીન ટેસ્ટ ન્યુસન્સ કરનારા નાગરિકો સામે કાનૂની પગલા ભરવા. ખાણી પીણીની હોટેલ, લારી ગલ્વા તેમજ તેવી અન્ય તમામ સંસ્થાઓમાં આરોગ્ય વિષયક તપાસની કામગીરી જાહેર જાજરૂ/પિશાબદાનીની સફાઈની કામગીરી જાહેર મનોરંજનના સ્થળો જેવા કે સિનેમા, નાટ્યગૃહો વિગેરેની આરોગ્ય વિષયક તપાસ રોગચાળા અંગેની પ્રાથમિક માહિતી મેળવી ઉચ્ચ અધિકારીને તાકીદ જાણ કરવી તેમજ રોગ અટકાયત પગલાની કામગીરી. ઈ-ગવર્નન્સ, કમ્પલેઇન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળના અમલીકરણની ફરિયાદ નોંધવાની કામગીરી. નાગરીક સેવાને લગતી ફરિયાદો જેવી કે આરોગ્યને લગતી ફરિયાદોની ૨૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની તથા ફરિયાદીને તેની જાણ કરવાની પ્રથા નાગરિકોને મહાનગરપાલિકાના સંચાલન માટેની તમામ વિગતો ઉપલબ્ધ થઈ શકે તે માટે નાગરિક અધિકાર પત્રનાં આરોગ્ય વિભાગને લાગત વિગતો. દરેક વોર્ડ વાઈજ રોજેરોજ પાણીનાં નમુના બેકોરીયોલોજીકલ / કેમીકલ ટેસ્ટ માટે મેળવી તેનું પૃથ્વકરણ કરી ગંદા પાણીનાં અનુસંધાનમાં આરોગ્ય વિષયક કામગીરી.
મદદનીશ આરોગ્ય નિરીક્ષક	<ul style="list-style-type: none"> આરોગ્યલક્ષી તમામ કામગીરી તેમજ એ.આઈ.ઓ.શ્રી તેમજ સેનેટરી ઈન્સ્પેક્ટરોનાં સલાહ સુચન મુજબ તમામ પ્રકારની કામગીરી, પ્રાયમરી હેલ્થ વર્કર તથા બેલદાર અને સફાઈ કામદારો પાસે લેવી. પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદાર પાસે અસરકારક કામ લેવાની કામગીરી તથા હાજરી નિયંત્રણ
વી.બી.ડી.સી.વિભાગ	
આસી. જંતુનાશક અધિકારી –	<ul style="list-style-type: none"> સમગ્ર જોન વિસ્તારમાં વાહકજનિત રોગ નિયંત્રણ અંગેની કામગીરીનું મોનીટરીંગ તેમજ સુપરવિઝન, સર્વેલન્સ (પેરા સાઈટોલોજીકલ મેજર્સ, ઈન્ટ્રાડોમેસ્ટિક સર્વે) વિકલી એન્ટીલાર્વલ, એન્ટી એડલટ (ફોંગીંગ IRS), હેલ્થ એજયુકેશન, ઈમ્પલીમેન્ટેશન ઓફ બાયલોજ વિગેરે કામગીરી પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ.
પ્રાયમરી હેલ્થ વર્કર –	<ul style="list-style-type: none"> ઈન્ટ્રા. ડોમેસ્ટિક સર્વેલન્સ અંગેની કામગીરી તથા એન્ટીલાર્વલ અંગેની કામગીરી, ફોંગીંગ અંગેની કામગીરી.

મુકાદમ -	- આરોગ્યલક્ષી તમામ કામગીરી
ગુમાસ્તાધારા વિભાગ	
દુકાનધારા નિરીક્ષક -	<ul style="list-style-type: none"> - ગુજરાત દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ - ૨૦૧૮ માં જણાવ્યા મુજબની તમામ ફરજો બજાવવી જેવી કે, સંસ્થાની નોંધણી થયેલ છે કે કેમ? તેમજ સંસ્થાનાં કામ કરતાં કર્મચારીઓનાં હાજરી પત્રક, પગાર પત્રક વિગેરેની તપાસ તથા ધારભંગની નામદાર ખૂનિ.કોર્ટ માં ફરિયાદ દાખલ કરવી. - બોંઘે લેબર વેલફેર ફર્ડ અધિનિયમ ૧૯૫૭ની અમલીકરણ કરાવવું. - ગુજરાતના દુકાનો અને સંસ્થાઓના અધિનિયમોનાં નિયમ જોગવાઈઓનું અમલીકરણ કરાવવું - કર્મચારી જીવન વીમા અધિનિયમ ૧૯૮૦ ની જોગવાઈઓનું પાલન કરાવવું. - ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા અધિનિયમ ૧૯૭૫ અમલીકરણ માટેની ફરજો બજાવવી અને વ્યવસાય વેરાને લગતી તમામ કામગીરી તથા વ્યવસાય વેરા / ગુમાસ્તાધારાની સાથે સંકળાયેલા સ્ટાઇની કામગીરી પર સુપરવિઝન કરવું.
આકારણી અને વસુલાત વિભાગ એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફિસર	<ul style="list-style-type: none"> - સુરત મહાનગરપાલિકાનાં વિસ્તારમાં આવેલ મિલ્કટોની સર્વેયર મારફત આકારણી દફ્તરે વેરાનાં હેતુ માટે એસેસમેન્ટ કરી ખાસ નોટીસ બજાવડાવવી તથા નોંધણી કરવી. - આવી મિલ્કટોની માટેનું એસેસમેન્ટ રજીસ્ટર, કટબુક રજીસ્ટર તથા તેને આનુસારિક અન્ય રેકર્ડની જાળવણી કરવી/ કરાવવી. - મિલ્કટોની આકારણી થથા બાદ તેના યોગ્ય તે સમયે વેરા માટેનાં બીલો તૈયાર કરવા તથા તે ખૂનીસીપલ વેરાની રીકવરી કરવી. - જો મિલ્કટ વેરાની વસુલાત ન થાય તો જી.પી.એમ.સી. એકટની જોગવાઈ મુજબ નક્કી કરેલ સમય મર્યાદામાં નોટીસ, વોરંટની બજાવણી ત્યાર બાદ, મિલ્કટોની જપી/ટાંચમાં લઈ વેરા વસુલાતની આગળની કાર્યવાહી કરવી. - મિલ્કટોની થયેલ આકારણીનું રજીસ્ટર જાહેર જનતા માટે ખુલ્લું મુકવું અને તેમાં આવેલ વાંધાઓ એપેલેટ ઓફિસર ધ્વારા સુનાવણી કરવાની વ્યવસ્થા કરવી. - એપેલેટનાં થયેલ હુકમનો અમલ કરવો. તેની ખાસ નોટીસ બજાવવી. - વખતોવખત મિલ્કટોનાં માલિકો, ધારણકર્તાઓ, કબજેદારનાં નામ રજુ કરેલ દસ્તાવેજી પુરાવાઓને આવિન આકારણી દફ્તરે ફેરફાર કરવા. - અરજદાર તરફથી આવતી નવી મિલ્કટ માટેની આકારણી કરવાનાં હેતુ સારુ આવતી અરજીઓ સ્વીકારી તેવી નવી / ફેરફાર થયેલ મિલ્કટોની આકારણી કરી આકારણી દફ્તરે ચઢાવી તેની રીવાઈજ નોટીસ આપી બીલ ઈસ્યુ કરવા. - હોદ્દાની રૂએ વ્યવસાય વેરા અધિકારી તરીકેની ફરજો અદા કરવી. - આર.ટી.આઈ. એકટ અન્યથે જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજો અદા કરવી.
કાયદા વિભાગ આસી.લો ઓફિસર અને એપેલેટ ઓફિસર	<ul style="list-style-type: none"> - સાઉથઝોનનાં વિવિધ ખાતા ધ્વારા માંગવામાં આવતા કાનુની અભિપ્રાય આપવાની કામગીરી - એડવોકેટશ્રીનાં વકીલ ફી નાં બીલનાં વ્યાજબીપણાનાં અભિપ્રાયની કામગીરી - જોનનાં કોર્ટ કેસો બાબતે જરૂરી કાનુની માર્ગદર્શન પુરુ પાડવાની કામગીરી - ડીસ્ટ્રીક્ટ કોર્ટ કેસ, લેબર કોર્ટ કેસો, સીવીલ કેસોનું મોનીટરીંગની કામગીરી - જરૂરીયાત જણાયે હાઈકોર્ટનાં એડવોકેટ સાથે ચર્ચા કરવા હાઈકોર્ટ/ગાંધીનગર જવાની કામગીરી - મિલ્કટોની આકારણી અનુસંધાને થયેલ હરકત અરજી અંગેની કાર્યવાહી કરવા અંગેની કામગીરી - કાયદા વિભાગનાં જાહેર માહિતી અધિકારી તરીકેની કામગીરી
મહેકમ વિભાગ	
પસોનેલ ઓફિસર -	<ul style="list-style-type: none"> - સમગ્ર ઝોનના વહીવટી અધિકારી તરીકેની કામગીરી - આંતરીક ખાતાકીય તપાસને લગતી તમામ કામગીરી, - મહેકમને લગતી તમામ કામગીરીનું નિયંત્રણ. - તાબા હેઠળના કર્મચારીઓની કામગીરીનું અસરકારક નિયંત્રણ અને અન્ય વહીવટી કામગીરી. - ઝોનના મહેકમ સંબંધિત બાબતે જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજ અદા કરવી.

હિસાબી વિભાગ		
૩. એકાઉન્ટન્ટ -	-	હિસાબોને લગતી તમામ કામગીરી, - બજેટ, જનરલ એડવાન્સ, ડીપોઝીટ, આવક-ખર્ચને લગતી તમામ કામગીરી, - ઓડિટ ઓફિશનનો નિકાલ, - રિકુપમેન્ટની કામગીરી, - પોતાના હાથ નીચેના કર્મચારી / કામદારની કામગીરીનું અસરકારક નિયંત્રણ તથા હાજરી નિયંત્રણ. - આર.ટી.આઈ. એક્ટ અન્યે જાહેર માહિતી અધિકારી તરીકની ફરજો અદા કરવી - હિસાબી ખાતાના બીલ તથા વહીવટી વિભાગમાં કામગીરી કરતા કર્મચારીની વિગત.
૧) પ્રથમ શ્રેષ્ઠી કલાર્કની કામગીરી	૧.	એમ.બી. સિવાયનાં ઈલેક્ટ્રોિક કંપની, જી.ઈ.બી., સોસાયટી અનુદાનનાં બીલો, સો.સા.રીફ્ડ બીલો, EMD \SD\SC રીફ્ડ તથા અન્ય તમામ પ્રકારનાં રીફ્ડ બીલોની ચકાસણી કરવી તથા તેની ડબલ એન્ટ્રી કરી પેમેન્ટ ઓર્ડર કરવા. ૨. સરકારી- અર્ધસરકારી સ્તરે માંગવામાં આવતી વિવિધ પ્રકારની માહિતીઓનું સંકલન કરી / તૈયાર કરી લાગત જગ્યાએ પાઠવવાની કાર્યવાહી કરવી. ૩. કેપીટલ ખર્ચના રીકન્સીલેશનની કાર્યવાહીમાં ચેકીગ કલાર્કને મદદ કરવી તથા ડીપોઝીટ ખર્ચનાં રજીસ્ટરોનું ડીસ્પેચ કલાર્ક સાથે સંકલનમાં રહીને રીકન્સીલેશન કરાવું. ૪. ફીક્ડ એસેટસના પત્રકોનું હિસાબી શાખા સાથે ચેકીગ કલાર્કની સાથે સંકલનમાં રહીને રીકન્સીલેશન કરાવું.
	૫	૫. પુરક બજેટ / વાર્ષિક બજેટ તૈયાર કરવું
	૬	ઓડિટ ઓફિશન વિષયક તમામ કામગીરી કરવી.
	૭	સ્ટોર એકાઉન્ટનું પોસ્ટીગ કરાવી લાગત સ્ટોક ખાતેથી માહિતીઓ મેળવી મુખ્ય હિસાબી કુચેરી સાથે રીકન્સીલેશન કરવું.
	૮	ચેકીગ કલાર્ક ડબલ એન્ટ્રી કર્યા બાદ તમામ પ્રકારના (M.A.COD) બીલનું ચેકીગ કરવું.
	૯	હિસાબી વિભાગનાં હેડ કલાર્ક તરીકે પત્ર વ્યવહાર તથા અન્ય કામગીરીઓ કરવી.
(૨) ચેકીગ કલાર્ક ની કામગીરી (દ્વિત્ય શ્રેષ્ઠી)	૧.	પ્રથમ શ્રેષ્ઠી કલાર્કને સોપેલ સિવાયના તમામ પ્રકારનાં રેવન્યુ તથા કેપીટલ કામોના બીલોની સંપૂર્ણ ચકાસણી કરવી તથા એમ.બી. માં પેમેન્ટ અંગે નોંધ કરવી.
	૨	હિસાબી શાખામાં બીલો મોકલતા પહેલા તમામ બીલોની ડબલ એન્ટ્રી / ચેકીગ કરી પેમેન્ટ ઓર્ડરનાં શેરા મારવા.
	૩	જનરલ એડવાન્સ ખર્ચ તથા રિકુપમેન્ટ બીલો બનાવવા તથા જન.એડવાન્સનું રીકન્સીલેશન કરવું.
	૪	કેપીટલ કામોનાં ખર્ચાઓનું રીકન્સીલેશન કરવું
	૫	મ્યુ.સભ્યો / ધારાસભ્યો / સાંસદ સભ્યો તેમજ અન્ય પ્રકારની ગ્રાંટનાં રજીસ્ટર નિભાવવા તથા આનુસંગીક માહિતીઓ તૈયાર કરવી.
	૬	હિસાબી વિભાગમાં આવતા તમામ બીલ, એમ.બી.પત્ર વ્યવહાર વિગેરે સ્વીકારી ઈનવર્ડ કરવા અંગેની કામગીરી કરવી.
	૭	વાર્ષિક બજેટ તૈયાર કરવામાં હેડ કલાર્કને મદદ કરવી.
(૩) બીલ કલાર્ક ની કામગીરી (દ્વિત્ય શ્રેષ્ઠી)	૧.	રેવન્યુ તથા કેપીટલ ખર્ચ ડિપોઝીટ રીફ્ડ તેમજ અન્ય તમામ પ્રકારના બીલો તૈયાર કરવાની કામગીરી કરવી.
	૨	ડીસ્પેચ કલાર્ક સાથે સંકલનમાં રહી તમામ પ્રકારના ખર્ચ રજીસ્ટરો / ડીપોઝીટ ખર્ચ રજીસ્ટરો મેઈન્ટેઇન કરાવવા તથા ખર્ચ વિષયક માહિતીઓ સમયાંતરે તૈયાર કરવી.
	૩	રેવન્યુ ખર્ચના રજીસ્ટરોનું ડીસ્પેચ કલાર્ક સાથે સંકલનમાં રહી હિસાબી કુચેરી સાથે રીકન્સીલેશન કરવું.
	૪	હિસાબી વિભાગનાં તેમજ વિવિધ દફ્તરોને કોમ્પ્યુટરાઈઝ કરવા અંગેની કામગીરી તાકીદે પૂરી કરવી.
	૫	ડીસ્પેચ કલાર્કની ગેરહાજરીમાં બીલ ડીસ્પેચ કરવા અંગેની કામગીરી કરવી.
	૬	વાર્ષિક બજેટ તૈયાર કરવામાં હેડ કલાર્કને મદદ કરવી

(૪) ડિસ્પેચ કલાર્ક ની કામગીરી (ત્રીજી શ્રેણી)	૧	તમામ પ્રકારના ખર્ચ રજીસ્ટરો નિભાવવા તથા રેવન્યુ ખર્ચનું રીકન્સીલેશન કરવામાં બીલ કલાર્કને મદદ કરવી.
	૨	વિવિધ પ્રકારના ડિપોઝીટ રીફંડ (ખર્ચ) રજીસ્ટરો નિભાવવા તથા તેનું રીકન્સીલેશન કરવું.
	૩	તૈયાર કરેલા બીલોનું ડિસ્પેચ કરવું તથા બીલોની ઓસ્સી. અને ફિક્ષ એસેટસના પત્રકો ફાઈલીંગ કરવા.
	૪	ઝોનમાં આવતા હિસાબી ખાતાને લાગત તમામ પ્રકારનાં પત્ર વ્યવહારોનું વર્ગીકરણ મુજબ ફાઈલીંગ કરવું.
	૫	ઓડિટ રજીસ્ટરો નિભાવવાની કામગીરીમાં હેડ કલાર્કને મદદ કરવી. હિસાબી ખાતાના કેશ વિભાગમાં કામ કરતા કર્મચારીઓને મદદ કરવી.
(૧) પ્રથમ શ્રેણી કલાર્કની કામગીરી (હેડ કેશીયર)	૧	કેશીયર સ્લીપ તૈયાર કરવી અને ભરણા સ્વીકારવા.
	૨.	બેંક સ્લીપ વાઉચર, કેશ રીશીપ્ટ વાઉચર, કેશ પેમેન્ટ વાઉચર તથા ઓવર ઓલ રીપોર્ટ તૈયાર કરવા.
	૩	રીકન્સીલેશનની કામગીરીમાં મદદ કરવી.
	૪	મુખ્ય કચેરીએ તે-બુકમાં આવક-જાવકની નોંધ કરવી.
	૫	ઓડિટ ઓફ્જિઝલનાં નિકાલ કરવા.
	૬	બેંક સાથે ચાર્જીસ બાબતે યોગ્ય કામગીરી કરવી.
	૭	ઝોનની બુકમાં આવક - ખર્ચની માહિતીની નોંધણી કરવી તેમજ તે-બુક તૈયાર કરવી.
	૮	ઓપરેટીવ અને નોન ઓપરેટીવ એકાઉન્ટના બેંક રીકન્સીલેશનની કામગીરી કરવી.
	૯	હેડ કેશીયરની રજા દરમ્યાનની તમામ કામગીરી કરવી.
	૧૦	ઓડિટ ઓફ્જિઝલના નિકાલમાં મદદ કરવી.
(૨) જુની. કલાર્ક (ત્રીજી શ્રેણી)	૧	જુદા જુદા વોર્ડ માંથી આવતી રોકડ જમા લેવા.
	૨	સીધાવેરા - વ્યવસાયવેરા વિભાગની રોકડ તથા ચેક જમા લેવા.
	૩	ઉપરોક્ત બંને વિભાગની જનરલ વાઉચર અને બેંકનું રીસીપ્ટ વાઉચર તૈયાર કરવા.
	૪	જનરલ આવકની નોંધ રજીસ્ટરમાં રાખવી.
	૫	બેંકમાં કેશ તેમજ ચેક જમા કરાવવામાં યોગ્ય મદદ કરવી.
સેક્શન ઓફિસર	-	કર્મચારીઓ નિયમીત ફરજ પર હાજર રહે છે કે નહિ તેનું નિયંત્રણ.
	-	તાબા હેઠળનાં કર્મચારીઓ પાસેથી લાગત ખાતા સંબંધિત લેવાની કામગીરી,
	-	ગર્વમેન્ટ તરફથી માંગ્યા મુજબની માહિતી નિયમીત જાય છે કે નહિ તે જોવું,
	-	સેક્શનમાં દરેક દફતરોને લગતી જવાબદારી તથા અન્ય સુપરવાઈઝરીંગ પ્રકારની કામગીરી,
	-	મહેકમને લગતી તમામ કામગીરી, રેકર્ડ નિભાવણીની કામગીરી, વ્યવસ્થાપન અને સંકલનની ફરજ
	-	ઝોનનાં વહીવટને લગતી કામગીરી અને જુદા જુદા ખાતાઓની માહિતીઓનાં સંકલનની કામગીરી
	-	પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારી / કામદારની કામગીરી તથા અન્ય વિગતોએ અસરકારક નિયંત્રણ / સુપુરવિજન
	-	હાજરી પત્રકની નિભાવણી.
	-	સંબંધિત ખાતાનાં મદદનીશ માહિતી અધિકારી તરીકેની ફરજ અદા કરવી.
પ્રથમ શ્રેણી કલાર્ક	-	ઓડિટ ઓફ્જિઝલનો નિકાલ કરવાની કામગીરી,
	-	હેડ કલાર્ક તરીકેની ફરજો અદા કરવી.
	-	આ કામગીરી જે તે ખાતાવાર અલગ અલગ પ્રકારની આ ઉપરાંત ખાતાનાં વડા અધિકારી સોએ તે કામગીરી કરવાની રહે છે.
	-	પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીની કામગીરી / હાજરીની કામગીરીની ચકાસણી તથા વર્તણૂક બાબતે અસરકારક સુપરવિજનની કામગીરી.
બીજી શ્રેણી કલાર્ક -	-	તે ખાતામાં સોંપવામાં આવતી ખાસ પ્રકારની જવાબદારીઓ જેવી કે, સભ્યશ્રીઓ તરફથી સ્ટેન્ડીંગ કમીટી, સામાન્ય સભામાં પુછવામાં આવતા સવાલોનાં જવાબો તૈયાર કરવાની કામગીરી. આમ, દરેક ખાતા પ્રમાણે કામગીરીમાં ફેરફાર રહે છે.
	-	સંબંધિત ખાતાનાં કેશ કાઉન્ટરની કામગીરી,

	<ul style="list-style-type: none"> - તે બુક, રીટર્ન ચેક, શિક્ષણ ઉપકર, કુરીયરની કામગીરી, - સર્વેયરની કામગીરી, તુમાર તૈયાર કરવા - સ્ટોર વિભાગની કામગીરી, - રાઇટ ટૂ ઈન્ડોર્મેશન એક્ટ હેઠળની માહિતી ઉપલબ્ધ કરવી. - ગુમાસ્તા વિભાગ / પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવાની કામગીરી - રેકર્ડની કામગીરી પર દેખરેખ રાખવી, રેકર્ડ એ, બી, સી, ડી, વાઈજ રેકર્ડ ગોઠવવો - જમીન મિલકત વિભાગ ધ્વારા જોન વિસ્તારમાં ડે.ઈજનેરશ્રીની સુચના મુજબ મહાનગર પાલિકાનાં સામાજિક સુવિધા આપવાનાં હેતુ માટે નડતરરૂપ ઝુંપડપટ્ટીનાં સર્વેની કામગીરી - એસ્ટાબ્લિસ્ટમેન્ટ તથા ઈન્કવાયરી કલાર્ક તરીકેની કામગીરી. - ફસ્ટ ગ્રેડ કલાર્કની ગેરહાજરીમાં તેમને સોંપવામાં આવેલ કામગીરી.
ત્રીજી શ્રેણી કલાર્ક	<ul style="list-style-type: none"> - જાહેર જનતા તરફથી આવતી અરજીઓ સ્વીકારી તેની પહોંચ આપવાની કામગીરી એટલે કે ઈન્વર્ડ, આઉટવર્ડ એમ બંને પ્રકારની કામગીરી, જે તે ખાતામાંથી આવતા પત્રનો નિકાલ વિગેરે કામગીરી, - ટેન્ડર કલાર્કની કામગીરી, - ફિલ્ડબુક કલાર્કની તેમજ વૌડ ઈન્સ્પેક્ટરની કામગીરી, - જન્મ-મરણ-લગ્ન નોંધણીની કામગીરી, રેકર્ડની કામગીરી સીવીક સેન્ટર કેશ કલેક્શન, - હરકત અરજીનાં રીપોર્ટ રજુ કરવા તથા સ્થળ તપાસની કામગીરી - જમીન મિલકત ખાતાને લગતી જેવી કે ટેનામેન્ટનાં સ્થળ પર હપ્તા વસુલાત, મહાનગરપાલિકાનાં શોપીગ સેન્ટરનાં ભાડા વસુલાત, મંડપ ફી, ઈલક્ટ્રોટ સબ-સ્ટેશન જમીન ભાડા, દુધ સહકારી મંડળીનાં ડેપોનાં જમીન ભાડા, ખાનગી સર્વીસ પ્રોવાઈડર કંપનીઓની લાઈન/કેબલનાં ભાડા, સુ.ડી.ટેલીફોનને ફાળવેલ જગ્યાનાં ભાડા વસુલાત, લાગત સ્કુલ ભાડા, પે એન્ડ યુઝ ટોયલેટનાં ભાડા, હોકીગ, અપંગ તથા વિધવાઓને ફાળવેલ જગ્યાના ભાડા વિગેરે વસુલાતની કામગીરી, આવેલ અરજીઓ અંગે સ્થળ તપાસ અને નિકાલ તેમજ ઉપરોક્ત સમગ્ર કામગીરીઓને લગતી આનુસંધિક પેપર વર્ક કામગીરી વિગેરે.


સામાન્ય બાબત

સુરત મહાનગરપાલિકાનો સમગ્ર વહીવટ અને કામગીરી અલગ અલગ ખાતાઓમાં વહેચાયેલ છે જેથી ખાતાવાર જે તે કર્મચારીઓને જે તે ખાતામાં ચાલતા કામ અનુસાર કામગીરી કરવાની રહે છે. પરંતુ સામાન્ય રીતે કર્મચારીઓને તેઓની કેડર અનુસાર કામગીરી સોંપવામાં આવે છે ત્રીજી શ્રેણીનાં કલાર્કને તેમની કેડરને અનુરૂપ કામગીરી તેમજ બીજી શ્રેણી કલાર્કને તેમની કેડરને અનુરૂપ કામગીરી સોંપવામાં આવે છે, જુદા જુદા ખાતામાં જુદા જુદા પ્રકારની કામગીરી જે-તે કર્મચારીને સોંપવામાં આવે તે જે તે કર્મચારીએ વિના સંકોચે સ્વીકારીદ લેવી જોઈએ. તે તેમની પ્રાથમિક ફરજ છે અને જે બાબતમાં કર્મચારીને સમજ ન પડે અગર તો અજાણ હોય તો તે બાબતનું માર્ગદર્શન કર્મચારીઓએ ઉપરી અધિકારી તરફથી મેળવી લેવું જોઈએ અને બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની વિસંગતતા ઉભી ન થાય તથા સહજ અને સુગમ રીતે કામગીરી થાય તેવો કર્મચારીએ પ્રયત્ન કરવો જોઈએ અને એવો અભિગમ રાખવો જોઈએ.

મુદ્રા નં .૦૩ :— નિર્ણય લેવાની પ્રક્રિયા સાથે ચેનલ દેખરેખ અને જવાબદારીની પ્રક્રિયા :—સાઉથઝોન—બી

Organization Structure - Zonal Leval

**MUNICIPAL COMMISSIONER
ZONAL CHIEF - DY. COMMISSIONER**



મુદ્રા નં.૦૪ :— સંસ્થાના કામના નિકાલ કરવાના ધોરણો :—

કલમ—૪ (૧) (ખ) (૪) ફરજો અદા કરવા માટે નિયત કરવામાં આવેલ ધારા ધોરણ/પદ્ધતિ અંગેની વિગત : કોઈપણ પ્રકારની ફરજો અદા કરવા માટે તેમજ માલ સામાનની ખરીદી માટે નીચે મુજબની પદ્ધતિ અપનાવવામાં આવે છે. કોઈપણ પ્રકારની કામગીરી સુપ્રત કરવા માટે

૧. ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવે છે.
૨. કવોટેશન મંગાવવામાં આવે છે
૩. માન્ય ઈજારદારોને સક્ષમ સત્તાધીશ ધારા નિયત થયેલ દરે કામગીરી સોંપવામાં આવે છે.

ટેન્ડરની પદ્ધતિ

૧. કોરા નિયત કરેલ ફોર્મમાં ટેન્ડર ઈસ્યુ કરવામાં આવે છે.
૨. ઓન લાઇન ઉપર ઈ—ટેન્ડરીંગ કરવામાં આવે છે જેમાં ટેડરની તારીખ અને તેની અંતિમ તારીખ પણ દર્શાવવામાં આવે છે.
(રૂ.૨.૦૦ લાખ થી વધુ કામગીરી માટે)
૩. પ્રિ—બીડ કોન્ફરન્સ (રૂ.૫૦ લાખ થી વધુ કામગીરી માટે)
૪. અંતિમ તારીખ સુધીમાં આવેલા ટેન્ડરોની રસીદ આપવામાં આવે છે.
૫. ટેકનીકલ બીડ ખોલવામાં આવે છે.
૬. ટેકનીકલ બીડનું મુલ્યાંકન કરવામાં આવે છે.
૭. માન્ય ઈજારદાર જણાતાં તેનું પ્રાઇસબીડ ખોલવામાં આવે છે.
૮. સમગ્ર ટેન્ડરીંગ પ્રક્રિયાનું મુલ્યાંકન કરવામાં આવે છે.
૯. ટેન્ડર સ્કુટીની/કમિટી સમક્ષ યકાસણી અર્થે રીપોર્ટ રજૂ કરવામાં આવે છે. (રૂ.૫ લાખથી વધુ ૨૫મ માટે)
૧૦. સ્ટેન્ડીંગ કમિટી/ખાસ સમિતિ સમક્ષ દરખાસ્ત કરવામાં આવે છે.
૧૧. સ્ટેન્ડીંગ કમિટી ધ્વારા ઈજારદાર નક્કી કરવામાં આવે છે.
૧૨. નક્કી કરેલ ઈજારદારને વર્ક ઓર્ડર આપવામાં આવે છે.

ફરજો અદા કરવા માટે વધુ વિગતોની જાણકારી માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in ઉપલબ્ધ છે. જે અવલોકનમાં લેવા વિનંતી.

મુદ્રા નં.૦૫ :— કાર્ય કરવાનાં નિયમો, સુચના, મેન્યુઅલ અને રેકર્ડની વિગતો :—

કલમ—૪ (૧) (બ) (૫) સંસ્થામાં નિભાવવામાં આવતાં દફ્તરીકરણની વિગતો મહાનગરપાલિકાની સમગ્ર કામગીરી સને ૧૯૪૮ નાં મુંબઈ પ્રાંતીય મહાનગરપાલિકાઓનાં અધિનિયમમાં નિર્દિષ્ટ જોગવાઈઓ અનુસાર હાથ ધરવામાં આવે છે અને તે સિવાય સુરત મહાનગરપાલિકાને ગુજરાત રાજ્ય સેવાના નિયમો, શોખ એન્ડ એસ્ટાભ્લીશમેન્ટ એક્ટ, મીનીમમ વેજીસ એક્ટ, પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ વિગેરે કાયદાઓ અનુસાર દફ્તરોની નિભાવણી કરવામાં આવે છે. આ બાબતે વધુ વિગતોની જાણકારી માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in ઉપલબ્ધ છે જે અવલોકનમાં લેવા વિનંતી.

મુદ્રા નં.૦૬ :— પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળનું દફ્તર :—

પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળનાં દફ્તરની વિગતો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે.

૪.૧ સરકારી દસ્તાવેજો વિશેની માહિતી આપવા નીચેના નમૂનાનો ઉપયોગ કરશો. જ્યાં આ દસ્તાવેજો ઉપલબ્ધ છે તેવી જગ્યાઓ જેવી કે સચિવાલય કક્ષા, નિયામકની કચેરી કક્ષા, અન્યનો પણ ઉલ્લેખ કરો. ('અન્યો' લખવાની જગ્યાએ કક્ષાનો ઉલ્લેખ કરો.)

મુદ્રા નં. ૬				
પ્રકરણ—૪				
જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિત્વો પાસેનાં દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક				
ક્રમ નં.	દસ્તાવેજની કક્ષા	—દસ્તાવેજનું નામ અને તેની એક લીટીમાં ઓળખાણ	દસ્તાવેજ મેળવવાની કાર્યપદ્ધતિ	નીચેની વ્યક્તિ પાસે છે./તેની નિયંત્રણમાં છે.
૧.	સરકારશ્રી	<ul style="list-style-type: none"> — ગુજરાત સીવીલ સર્વિસીઝ રૂલ્સ ૨૦૦૨ — બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૮ — બી.સી.એસ.આર.નાણાંકીય તથા અન્ય નિયમો — બી.સી.એસ.આર. — પેન્શન — નિયમો — ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો સને ૨૦૦૨ નો પરિચય — ગુજરાત મુલ્કી સેવા (મુસાફરી ભથ્થુ) નિયમો, ૨૦૦૨ નો પરિચય — નોકરીની સામાન્ય શરતોના નિયમો, ૨૦૦૨ — ગુજરાત મુલ્કી સેવા (પગાર) નિયમો સને ૨૦૦૨ નાં પરિચય — બોમ્બે એક્ટ — ૧૯૪૮ — ૮/૧૮/૨૭, નાણાંકીય, વર્તણુંક, શિસ્ત, પગાર, રજા વિગેરે નિયમોનો પરિચય ફક્ત ઠરાવો, હુકમો અને પરિપત્રો — ગુજરાત સરકાર તરફથી વખતો વખત બહાર પાડવામાં આવતા હુકમો, ઠરાવો (જી.આર.) વિગેરે. 	<ul style="list-style-type: none"> અરજી કરીને નિયત ફી ભરીને પહોંચ રજી કર્યાશી મળી શકશે. 	એસ્ટાભ્લીશમેન્ટ શાખા

૨		- જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ - ટાઉન પ્લાનીગ એક્ટ.		શહેર વિકાસ વિભાગ
૩		- માર્કેટ બાય લોજ - માંસ, માછલી અને નોન - વેજીટેબલ ખાદ્ય પદાર્થોના ખાનગી જગ્યાઓ ઉપર વેચાણ પર આપવામાં આવતા લાઈસન્સ અંગેના નિયમો. - પ્રિવેન્શન ઓફ કુઅલ્ટી ટુ એનીમલ (સ્લોટર હાઉસ) રૂલ્સ, ૨૦૦૧		આરોગ્ય વિભાગ
૪		- ખાતાકીય તપાસના નિયમો		ખાતાકીય તપાસ અધિકારીની કચેરી
૫		-જનરલ બોર્ડ મ્યુ. રૂલ્સ પાર્ટ-૧ અને પાર્ટ-૨		સેકેટરી ખાતુ
૬		- કમિશનરશ્રી તરફથી વખતો વખત બહાર પાડવામાં આવતા પરિપત્રો, નોંધ વિ.		મદ્યસ્થ કચેરી

(૧) રેકર્ડ રૂલ્સ પૈકીનાં તારવણી કરેલ કેટેગરી વાઈસ મહેકમ વિભાગને લાગત રૂલ્સ :—

ક્રમ	વિગત	કેટેગરી (રાખવા જોગ વર્ષ)
૧	(૧૧) સરકારશ્રીનાં ઠરાવો જેવા કે મ્યુનિ. ઈલેક્શનને લગતા ઓર્ડર, ઠરાવ,રૂલ્સ રેગ્યુલેશન,સ્ટેન્ડીંગ ઓર્ડર	(A) કાયમી રાખવા જોગ
૨	(૧૨) અગત્યનાં કાયમી વહીવટી પરિપત્રો, સ્થાયી આદેશો	
૩	(૧૭) ડી. પી. ઓર્ડર	
૪	(૨૫) જે તે પગારધોરણમાં નવી જગ્યાઓ ઉપસ્થિત કર્યા બાબતની તેમજ જગ્યાની મુદ્દત લંબાવવા બાબતની અને રદ કરાયેલ જગ્યાઓ અંગેની ફાઈલો	
૫	(૨૮) કર્મચારીઓને મળતા ભથ્થાં જેવા કે મૌખવારી ભથ્થું, ઘરભાડા ભથ્થું તેમજ જગ્યાઓ સાથે જોડાયેલ સ્પે.એલા.ની ફાઈલો	
૬	(૩૧) આઈ. ટી. એવોર્ડને લગતી ફાઈલો	
૭	(૮૮) B C D કેટેગરીનાં નાશ કરવા જોગ કાગળોની મંજૂરી તથા તેનું લીસ્ટ	
૮	(૧૦) સર્વિસ બુક	(B) ૩૫ વર્ષ રાખવા જોગ
૯	(૧) બીલની ચૂકવણી કર્યા અંગેનું રજીસ્ટર	(C) ૧૦ વર્ષ રાખવા જોગ
૧૦	(૪) પગાર અંગેના બીલો તથા એકવીટન્સ રોલ	
૧૧	(૫) ગેરહાજરી બાબતનું પત્રક	
૧૨	(૧૦) કર્મચારીઓનાં લેબર ડીસ્પ્લાય, આઈ.ટી. કેસ સંદર્ભનાં પેપર્સ	
૧૩	(૬) ટ્રાન્સફર એન્ટ્રી	
૧૪	(૩૭) પૈન્શન રજીસ્ટર	
૧૫	(૫૩) મસ્ટર રોલ	
૧૬	(૬૨) ઈનવર્ડ આઉટવર્ડ રજીસ્ટર	
૧૭	(૬૩) શીડ્યુલ પોસ્ટ, નિમાણુંક, પોસ્ટીંગ, ટ્રાન્સફર, બઢતી ઓર્ડર, લીવ પેપર્સ, સ્વીકારેલ અન્ય ખાતાની ફરજ, ડેપ્યુટેશન સ્પે. ટ્રેનીંગ, ડીસમીસ, અયોગ્યતા, વયનિવૃત્ત, છુટા થયા બાબતનાં, નીચલી પાયરી ઉપર ઉતારી	

	મુકવા બાબતનાં, ચેતવણી અને દંડ કર્યા બાબતનાં તેમજ ખતાકીય તપાસનાં પેપર્સ	
૧૮	(૬૪) પેન્શન ગ્રેજ્યુએટીની સંમતિ આપતા પેપર્સ	
૧૯	(૬૫) હંગામી અને કામચલાઉ કર્મચારીઓનાં પેપર્સ	
૨૦	(૬૬) હાલનાં પગારધોરણ અને સીનીયોરીટી મુજબ તૈયાર કરેલ કર્મચારીઓનું લીસ્ટ	
૨૧	(૭૦) કર્મચારીઓ પાસેની વસુલાત બાબત : પુરેપુરી થયેલ વસુલાત અંગેની સેવાપોથીમાં નોંધ કરવા બાબત.	
૨૨	(૭૮) પરયૂરણ પત્રવ્યવહારની વિગત રાખવાનું રજીસ્ટર.	
૨૩	૨૪ (૮૧) મ્યુનિ. એક્ટ, નિયમ, વિનિયમમાં થયેલ ગુના બાબતેની ફરીયાદને લાગત પત્રવ્યવહાર	
૨૪	(૧૮) પટાવાળાની ટપાલ બુક	
૨૫	(૧૯) મ્યુનિ. સર્વિસમાંથી આપેલ રાજીનામા અંગેનાં પેપર્સ	
૨૬	(૨૨) કાયમી કર્મચારીઓનું મસ્ટર અને સમયપત્રક	
૨૭	(૨૩) મ્યુનિ. રેકર્ડનો ઉતારો મેળવવા અંગેની અરજી.	
૨૮	(૪૬) પેન્શન મેળવતા કર્મચારીઓનું રજીસ્ટર	

(D)
૫ વર્ષ રાખવા જોગ

(E)
૨ વર્ષ અથવા ઓડીટ
થયેલ
(જે પહેલું હોય તે)

(૨) રેકર્ડ રૂલ્સ પૈકીનાં તારવણી કરેલ કેટેગરી વાઈસ આર.ટી.આઈ સેલને લાગત રૂલ્સ :—

ક્રમ	વિગત	કેટેગરી (રાખવા જોગ વર્ષ)
૧	૧ આર.ટી.આઈ.એક્ટ-૨૦૦૫ હેઠળ આવતી મુણ અરજીઓનું રજીસ્ટર	(A) કાયમી રાખવા જોગ
૨	આર.ટી.આઈ.એક્ટ કલમ ૧૮(૧) હેઠળ નાગરીકો તરફથી કરવામાં આવતી પ્રથમ અપીલ અરજીઓનું રજીસ્ટર.	
૩	પ્રથમ અપીલ અરજીઓની ફાઈલો.	
૪	૪ ગુજરાત માહિતી આયોગમાં નાગરીકો તરફથી કરવામાં આવતી બીજી અપીલોની ફાઈલો.	
૫	૫ ટપાલ બુકો	
આર.ટી.આઈ.સેલ દ્વારા પ્રોએક્ટીવ ડિસ્કલોગરની ફાઈલ અને ઠરાવો / હુકમો / પરીપત્રો / નોંધ વગેરે નીતિ વિષયક ફાઈલ.		

(૩) રેકર્ડ રૂલ્સ પૈકીનાં તારવણી કરેલ કેટેગરી વાઈસ એક્ઝિન્યુન્ટ વિભાગને લાગત રૂલ્સ :—

ક્રમ	વિગત	કેટેગરી (રાખવા જોગ વર્ષ)
૧	રેવન્યુ ખર્ચ રજીસ્ટર	(A) કાયમી રાખવા જોગ
૨	કેપીટલ ખર્ચ રજીસ્ટર	
૩	જનરલ એડવાન્સ રજીસ્ટર	
૪	કેપીટલ અને રેવન્યુ ખર્ચ ઓ.સી. વાઉચર	
૫	આઉટ વર્ડ રજીસ્ટર	(D) ૦૫ વર્ષ રાખવા જોગ

(૪) રેકર્ડ રૂલ્સ પૈકીનાં તારવણી કરેલ કેટેગરી વાઈસ વી.બી.ડી.સી. વિભાગને લાગત રૂલ્સ :—

ક્રમ	વિગત	કેટેગરી (રાખવા જોગ વર્ષ)
૧	સ્ટોક બુક, વાઉચર બુક, ઈન્ફેન્ડ બુક, વાઉચર ફાઇલ, ઈન્વર્ડ રજીસ્ટર, આઉટવર્ડ રજીસ્ટર	(D) ૦૫ વર્ષ રાખવા જોગ
૨	હાજરી પત્રક	(E) ૦૨ વર્ષ રાખવા જોગ

(૫) રેકર્ડ રૂલ્સ પૈકીનાં તારવણી કરેલ કેટેગરી વાઈસ આરોગ્ય વિભાગને લાગત રૂલ્સ :—

ક્રમ	વિગત	કેટેગરી (રાખવા જોગ વર્ષ)
૧	આઉટ વર્ડ રજીસ્ટર	(B) ૩૫ વર્ષ રાખવા જોગ
૨	ઇન્વર્ડ રજીસ્ટર	
૩	મેયરફંડ રજીસ્ટર	
૪	અનુદાન સોસાયટી	
૫	મેન્યુઅલ રસીદબુક	(C) ૧૦ વર્ષ રાખવા જોગ
૬	ટ્રેકટર / નાઈટ સ્કેપીંગ – બ્રશીંગ કોન્ટ્રાક્ટરની ફાઇલો (ચુકવાયેલ બીલ તથા ચુકવવાના બાકી બીલ)	
૭	ટપાલ બુક	
૮	ના.આ.અધિકારીશ્રીને ફાળવેલ ગાડીઓની લોગબુક	(D) ૦૫ વર્ષ રાખવા જોગ
૯	આર.ટી.આઈ.રજીસ્ટર	(A) કાયમી રાખવા જોગ

(૬) રેકર્ડ ટૂલ્સ પૈકીનાં તારવણી કરેલ કેટેગરી વાઈસ આકારણી વિભાગને લાગત ટૂલ્સ :—

ક્રમ	વિગત	કેટેગરી (રાખવા જોગ વર્ષ)
૧	ગ્રામ પંચાયત ઠરાવ બુક	(A) કાયમી રાખવા જોગ
૨	આર.ટી.આઈ. ઇનવર્ડ/આઉટવર્ડ અરજી ૨જીસ્ટર	
૩	બી, સી, ડી, ઈ કેટેગરી મુજબ નાશ કરેલ રેકર્ડની યાદી	
૪	એસેસમેન્ટ ૨જીસ્ટર	
૫	ગ્રામ પંચાયત આકારણી ૨જીસ્ટર	(B) ૦૫ વર્ષ રાખવા જોગ
૬	કટબુક	
૭	નામફેર તુમાર	(C) ૧૦ વર્ષ રાખવા જોગ
૮	એડ બુક	
૯	૯ આકારણી તુમાર (બાંધકામ, ભાડુત દાખલ/કમી)	
૧૦	બીલ ચુકવણીની ફાઈલો	
૧૧	ડીમાન્ડ ૨જીસ્ટર	(D) ૦૫ વર્ષ રાખવા જોગ
૧૨	યુ.પી.સી. ૨જીસ્ટર	
૧૩	ડુપ્લિકેટ બીલો	
૧૪	ગ્રામ પંચાયત માંગણા ૨જીસ્ટર	
૧૫	પાણીનાં તુમાર	
૧૬	ડીમાન્ડ નોટીસ	
૧૭	વોરંટ	
૧૮	વોરંટ ૨જીસ્ટર	
૧૯	ઇન્ફેન્ટ બુક (રીકીવીમેટલ બુક)	
૨૦	ઇનવર્ડ, આઉટવર્ડ ૨જીસ્ટર	
૨૧	રીટર્ન ચેક ૨જીસ્ટર	૦૨ વર્ષ રાખવા જોગ
૨૨	અપીલ તુમાર	
૨૩	ડીફોલ્ટર ૨જીસ્ટર	
૨૪	વહીવટી અહેવાલ	
૨૫	સ્થાનિક ભંડોળના ઓડીટના કાગળો	
૨૬	ઓડીટને લગતા કાગળો (ચાલુ વાંધોઓ નિકાલ થયા બાદ પાંચ વર્ષ સુધી)	
૨૭	સાદર ૨જુ રીપોર્ટ O/C ફાઈલ	
૨૮	વાહનોના બીલ અંગેની ફાઈલ	
૨૯	રસીદ બુકો	
૩૦	ભરણાં રીપોર્ટ	
૩૧	ગ્રામ પંચાયત રસીદ બુક	
૩૨	બજેટને લગતી માહિતીની ફાઈલો	
૩૩	પર્સનલ એડવાન્સ ૨જીસ્ટર/ફાઈલ	
૩૪	કાયમી કર્મચારીઓના હાજરી પત્રકો	
૩૫	આકસ્મેક ૨જાના રીપોર્ટ/કાર્ડ	
૩૬	ટપાલ બુક	
૩૭	સામાન્ય પહોંચ	
૩૮	મુખ્ય અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ કચેરી હુકમ/નોંધ	
૩૯	ઓફિસરો અને કર્મચારીઓની ડાયરી	
૪૦	પરચુરણ ફાઈલો	

(૭) રેકર્ડ તુલ્સ પૈકીનાં તારવણી કરેલ કેટેગરી વાઈસ સાઉથઝોન-બી(કનકપુર) ગુમાસ્તાધારા વિભાગને લાગત તુલ્સ :—

ક્રમ	વિગત	કેટેગરી (રાખવા જોગ વર્ષ)
૧	શીન્યુ ફોર્મ—"ડી"	૨ વર્ષ અથવા ઓડીટ (E)
૨	ફોર્મ—"ઈ" ફેરફાર	૨ વર્ષ અથવા ઓડીટ (E)

(૮) રેકર્ડ તુલ્સ પૈકીનાં તારવણી કરેલ કેટેગરી વાઈસ સાઉથઝોન-બી(કનકપુર) કાયદા ખાતા/ઓપેલેટ વિભાગને લાગત તુલ્સ :—

ક્રમ	વિગત	કેટેગરી (રાખવા જોગ વર્ષ)
૧	દાવા રજીસ્ટર	કાયમી રેકર્ડ(A)
૨	આર.ટી.આઈ.રજીસ્ટર	કાયમી રેકર્ડ(A)
૩	હરકત અરજી રજીસ્ટર	૦૫(પાંચ) વર્ષ(D)
૪	ઈનવર્ક રજીસ્ટર	૦૫(પાંચ) વર્ષ(D)
૫	આઉટવર્ક રજીસ્ટર	૦૫(પાંચ) વર્ષ(D)

(૯) રેકર્ડ તુલ્સ પૈકીનાં તારવણી કરેલ કેટેગરી વાઈસ સાઉથઝોન-બી(કનકપુર) જન્મ-મરણ / લગ્ન નોંધણી વિભાગને લાગત તુલ્સ :—

ક્રમ	વિગત	કેટેગરી (રાખવા જોગ વર્ષ)
૧	જન્મ-મરણ નોંધણી રજીસ્ટર	૭૫ વર્ષ(એ-૬૮)
૨	જન્મ-મરણ મોડી માહિતી (લેઈટ-ફી) રજીસ્ટર	૭૫ વર્ષ(એ-૭૧)
૩	જન્મ-મરણની નોંધણી તેમજ સુધારાની એફીડેવીટ તેમજ નામ દાખલ કરવાની અરજી	૦૫ વર્ષ(દી-૧૫૪)
૪	જન્મ-મરણની નોંધ કે છે પોલીસ, દવાખાના વિગેરે તરફથી મળેલ હોય જેવી કે, જીવિત જન્મ રીપોર્ટ, ફોર્મ નં.૨, મૃત જન્મ રીપોર્ટ ફોર્મ નં.૩, મરણ રીપોર્ટ ફોર્મ નં.૪ તથા ૮ વિગેરે	૦૨ વર્ષ(૬-૭૧)
૫	લગ્ન નોંધણી રજીસ્ટર	કાયમી રાખવા જોગ
૬	લગ્ન રજીસ્ટર	કાયમી રાખવા જોગ

૭	મેરેજ સટીફિકેટ બુક	કાયમી રાખવા જોગ
૮	પહોંચ બુક	૦૫ વર્ષ
૯	૯ નોંધણી યાદી રજીસ્ટ્રાર જનરલને મોકલ્યા અંગેનાં ટપાલ ખાતાની પહોંચ	૦૫ વર્ષ
૧૦	૧૦ રજીસ્ટરના ઉતારો મેળવવા માટેની અરજીઓ	૦૫ વર્ષ
૧૧	૧૧ કેશબુક	૦૫ વર્ષ

મુદ્દા નં.૦૭ :— જાહેર જનતા સાથે પરામર્શ અંગેની વ્યવસ્થા :—

જાહેર જનતા સાથે પરામર્શ કરવાની વ્યવસ્થા અર્થે વોર્ડ સમિતિની રથના કરેલ છે. આ સમિતિ દર માસની સભામાં આરોગ્ય તથા ટેકનીકલ વિભાગનાં ઈજનેરો સાથે પરામર્શ કરી સુચનો તથા નીતિ અમલવારી અર્થે અગત્યના મુદ્દાઓ રજુ કરે છે. જે અંગે યોગ્ય પ્રક્રિયા અનુસરી નિર્ણયો કરવામાં આવે છે.

કલમ—૪ (૧) (ખ) (૭) સંસ્થાની ફરજો અદા કરવા માટે નીતિ વિષયક નિર્ણયો અને નીતિનિયમો નકદી કરનાર સત્તાધીશો તથા તેનું અમલીકરણ કરનાર અધિકારીઓની વિગતો સુરત મહાનગરપાલિકાનો સમગ્ર વહીવટ ઉપર જણાવ્યા મુજબ મુખ્યત્વે સને ૧૯૪૮ નાં મુંબઈ પ્રાંતીય મહાનગરપાલિકાઓના અધિનિયમની જોગવાઈઓ અનુસાર કરવામાં આવે છે. સદરહુ અધિનિયમમાં જણાવ્યા અનુસાર મુખ્યત્વે ૧૨ ચૂંટાયેલા સભ્યોની બનેલી સ્થાયી સમિતિ ધ્વારા નીતિ વિષયક નિર્ણય લેવામાં આવે છે અને તે મુજબ તેનું કમિશનરશ્રી અને તેના તાબા હેઠળનાં અધિકારીઓ ધ્વારા તેનું અમલીકરણ કરવામાં આવે છે. આ બાબતે વધુ વિગતોની જાણકારી માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ www.suratmunicipal.gov.in ઉપલબ્ધ છે જે અવલોકનમાં લેવા વિનંતી.

મુદ્દા નં.૦૮ :— બોર્ડ, કાઉન્સિલો, કમીટીઓ અને અન્ય બોડીઓની વિગતો :—

સાઉથઝોન-બી(કનકપુર) નાં ઝોન વિસ્તારની વોર્ડ કમિટિની માહીતી

ક્રમ	ઈલેક્શન વોર્ડ નંબર	ઈલેક્શન વોર્ડ વિસ્તાર	મ્યુ.સભ્યશ્રીનું નામ	હોદ્દો
૧	૩૦	કનકપુર - કનસાડ	શ્રી ચિરાગસિંહ હરેન્દ્રસિંહસોલંકી	મ્યુ.સભ્યશ્રી
૨			શ્રીમતી પિયુષાબેન ભરતભાઈ પટેલ	મ્યુ.સભ્યશ્રી
૩			શ્રી હસમુખભાઈ શંકરભાઈ નાયક (એડવોકેટ)	મ્યુ.સભ્યશ્રી
૪			શ્રી રીનાદેવી અજીતસિંહ રાજપૂત	મ્યુ.સભ્યશ્રી

કલમ-૪ (૧)(ખ)(૮) સંસ્થાની ફરજો અદા કરવા માટે સંસ્થાની સામાન્ય સભા તેમજ વિવિધ સમિતિઓની કરવામાંઆવેલ રચનાની બેઠકો તેમજ તેમાં લેવાયેલ નિર્ણયોની મીનીટ્સ અંગેની વિગતો :—

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પ્રતિ માસે ઓછામાં ઓછી એકવાર મળતી હોય છે. જેમાં જાહેર જનતા માટે પ્રેક્ષક ગેલેરીની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં બેસી તેઓ પણ આ કામગીરી નીછાળી શકે છે. તે સિવાય ૧૨ ચૂંટાયેલા સભ્યોની સ્થાયી સમિતી બેઠક પણ સપ્તાહમાં એક દિવસ નિયત કરેલા સમયે યોજવામાં આવે છે. જેમાં સામાન્ય નાગરિકોને પ્રવેશ આપવામાંઆવતો નથી. તે સિવાયની અન્ય ખાસ સમિતિઓ અને તદર્થ સમિતિઓની બેઠક સમયાંતરે મળતી હોય છે. આ સમિતિઓનાં એજન્ડા અને ઠરાવોની વિગતો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in ઉપર ઉપલબ્ધ છે જે અવલોકનમાં લેવા વિનંતી.

મુદ્રા નં.૮ :— સાઉથઝોન-બી(કનકપુર)ના અધિકારીઓ અને કર્મચારીઓની વિગતો :— બીસીએનટી વાઈઝ અધિકારી અને કર્મચારીઓની માહિતી www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે તથા કર્મચારીઓના મહેકમ દફતર તથા પગાર રજીસ્ટરની નકલ ઝોન ખાતે ઉપલબ્ધ છે.

મુદ્રા નં.૧૦ :— અધિકારીઓ અને કર્મચારીઓને ચૂકવાતા વેતનની વિગતો :— અધિકારીઓ અને કર્મચારીઓને ચૂકવાતા વેતનની વિગતો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે.

મુદ્રા નં.૧૧ :— દરેક ખાતા / ઝોનને ફાળવેલ અંદાજપત્રની વિગતો :— દરેક ખાતા/ઝોનને ફાળવેલ અંદાજપત્રની વિગતો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે.

મદ્દા નં. ૧૨:- ભ્યુ.કમિશનરશ્રી ધ્વારા મંજુર કરેલ લાભાર્થીઓની પાદી

સુરત મહાનગર પાલિકા

સાઉથઝોન-બી(કનકપુર)

આરોગ્ય વિભાગ

અનુદાન સ્કીમ હેઠળ ચાલતી સોસાયટીની વિગત

ક્રમ	વોર્ડ નં.	સોસાયટીનું નામ	સોસાયટી વિસ્તાર
૧	૩૦	શિવશક્તિ કો. ઓ. હાઉસીગ સોસાયટી લિ.	મુ. ૧-૨, શિવશક્તિ રો-હાઉસ, ૨જીસ્ટર નં. સા (હ) ૪૮૭૩/ ૨૦૧૭, તા. ૦૨/૦૪/૨૦૧૭, પારડી-કણાદે-સચીન
૨	૩૦	સાંઈ દર્શન રો-હાઉસ સર્વિસ સોસાયટી	પંચાયત ઓફિસ પાસે, સુરત-નવસારી રોડ, સચીન ગામ, સુરત - ૩૮૪૨૩૦
૩	૩૦	ઓમ રેસીડન્સી કો.ઓપ. હાઉસીગ સર્વિસ સોસાયટી લિ.	સર્વે નં. ૨૮, બ્લોક નં. ૩૩, ટી.પી.-૩૪, પાલી, સચીન, સુરત.-૩૮૪૨૩૦ ૨જીસ્ટર નં. SUR/ SA(HAA)-15329/ 2021
૪	૩૦	શિવાલીક રેસીડન્સી કો-ઓ. હાઉસીગ સોસાયટી	પ્રોપરી કાર્ડ નં. ૧૪, પાલી ગામતળ, પાલી ગામ સચીન, સુરત
૫	૩૦	ધોગેશ્વર પાર્ક સોસાયટી	સર્વે નં. ૩૭-૩૮, બ્લોક નં. ૬૧, પારડી-કણાદે, સુરત-નવસારી મેરીન રોડ, સચીન
૬	૩૦	રાધાકિશન રેસીડન્સી કો.ઓપ. હાઉસીગ સર્વિસ સોસાયટી લિ.	પારડી-કણાદે, તા. ચોર્યાંસી, જી. સુરત, ૩૮૪૨૩૦ ૨જીસ્ટર નં. REG/ SUR/ SA/ (HAA) 12852/ 2020 DT.27- 01-2020
૭	૩૦	ધર્મ ભક્તિ રેસીડન્સી કો. ઓપરેટીવ હાઉસીગ સર્વિસ સોસાયટી લિમિટેડ	પાલી, ૨જીસ્ટર નં. SUR/ SA(HAA)-13869/ 2021
૮	૩૦	તુલસી કલસ રેસીડન્સી A કો-ઓપ. હાઉસીગ સર્વિસ સોસાયટી લિમિટેડ	૨જીસ્ટર નં. SUR/ SA(HAA)-13730/ 2020 પારડી-કણાદે-સચીન
૯	૩૦	વીર નર્મદા હાઇટ્સ - ૦૧, ગુજરાત હાઉસીગ બોર્ડ	સરસ્વતી હિન્દી વિદ્યાલયની પાસે, જી. એચ.બી., કનકપુર, સચીન, સુરત - ૩૮૪૨૩૦
૧૦	૩૦	રાહત કો. ઓ. હાઉસીગ સોસાયટી	બ્લોક નં. ૨૬૫ થી ૨૬૮, પ્લોટ નં. ૫૭૫, રાહત કો. ઓ. હાઉસીગ સોસાયટી, ગલ્ફેઝી, સુરત, ૩૮૪૨૧૦
૧૧	૩૦	શ્રી તિરુપતિ બાલાજી ટાઉન કો. ઓ. હાઉસીગ સર્વિસ સોસાયટી	બ્લોક નં. ૨૨૨, સચીન જી.આઈ.ડી.સી. સર્કલની સામે, સચીન-મગદલા રોડ, સુરત. REG/SUR/SA(HAA)-11977/2018
૧૨	૩૦	મહાવીર સોસાયટી,	મહાવીર સોસાયટી, તલંગપુર રોડ, સચીન, સુરત. ૩૮૪૨૩૦

મુદ્રા નં. ૧૩ :- છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો :-

સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે.

મુદ્રા નં. ૧૪ :- ઈલેક્ટ્રોનિક ફોર્મમાં મળતી માહિતીઓ :-

ઈલેક્ટ્રોનિક ફોર્મમાં મળતી વિગતો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે.

મુદ્રા નં. ૧૫ :- માહિતી મેળવવા અંગે નાગરિકોને મળતી સુવિધાઓની વિગતો :-

નાગરિકોને મળતી સુવિધાઓની વિગતો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે.

સાઉથઝોન-બી(કનકપુર) નાગરિકોને આપવામાં આવેલ સુવિધાઓ (જાહેર પુસ્તકાલયો / રીડિંગ રૂમો) ની માહિતી :-

- (૧) પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં, બુડીયા ગામ, સુરત.
- (૨) સચીન મગદલા રોડ, ગલ્ફેષી ગામ, સુરત.
- (૩) ઉનગામ તળાવ પાસે, ઉન, સુરત.

:- પુસ્તકાલયોનો સમય : સવારે ૮:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી
:- પુસ્તક આપ-લે સમય : સવારે ૮:૩૦ થી સાંજે ૭:૩૦ કલાક સુધી (સોમવાર સિવાય)
:- જાહેર રજાના દિવસોમાં સમય : સવારે ૮:૦૦ થી બપોરે ૨:૦૦ કલાક સુધી
:- સભ્યપદ મેળવવા માટેનું અરજીપત્રક સુરત મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી,
વિના મુલ્યે મેળવી શકાશે.

મુદ્રા નં. ૧૬ :- જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્રા અને બીજી વિગતો :-

અપીલ અધિકારી / જાહેર માહિતી અધિકારીઓનાં નામ, હોદ્રા અને બીજી વિગતો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે તથા ઝોન કયેરી ખાતે બોર્ડ
ઉપર પણ પ્રસિદ્ધ કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

મુદ્રા નં. ૧૭ :— ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી :—

અન્ય માહિતીઓ સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે. અતેના ખાતાની અલાયદી માહિતી નથી.

આઈ.ડી.આઈ. એક્ટ હેઠળની અરજી માટે ૨જીસ્ટર નમૂનો—૧ અને અપીલ અરજી માટે ૨જીસ્ટર નમૂનો—૨ (પત્રક—૧ અને પત્રક—૨)ની તા.૦૧/૦૪/૨૦૨૧ થી ૩૧/૦૩/૨૦૨૨ સુધીની માહિતી સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in પર સંયુક્ત રીતે મુકવામાં આવેલ છે. (સોફ્ટ કોપી મજૂબ)

- (૧) અપીલ અધિકારી અને ઈ.ચા.આસી. કમિશનરશ્રી પ્રવિષ્ટકુમાર આર.પ્રસાદ (કર્મ. નં. ૩૪૬૩૫)
- (૨) અપીલ અધિકારી અને કાર્યપાલક ઈજનેરશ્રી રાજેશભાઈ સી.જરીવાલા (કર્મ નં. ૧૯૮૨૫)
- (૩) અપીલ અધિકારી અને નાયબ આરોગ્ય અધિકારી શ્રી ડૉ. એ.પી.ભડ્ક (કર્મ.નં. ૧૭૨૪૦)

વેબ સાઈટ :— www.suratmunicipal.gov.in.

સાઉથઝોન-બી (કનકપુર) ક્ષેત્રી
જાહેર માહિતી અધિકારીઓના નામ

અ.નં.	વિભાગનું નામ	જાહેર માહિતી અધિકારીના નામ /ઇંડ્રો/ કર્મચારી નં.
૧	મહેકમ	શ્રી પી.કે.જરીવાલા —ઈ.ચા.પર્સોનેલ ઓફિસર —૧૨૨૬૩
૨.	હિસાબી	શ્રી લીલુભાઈ કે. પટેલ—ડ.એકાઉન્ટન્ટ—૧૩૫૦૩
૩.	આકારણી અને સીવીક સેન્ટર	શ્રી ચેતન એસ.પાટીલ—એ.આર.ઓ.શ્રી —૩૭૧૮૭
૪.	ગુમાસ્તાધારા	શ્રી નીતીનકુમાર કે. ભાવસાર—૪૨૮૭૫ શ્રી મુસ્તુફારજાખાન અલ્લાહરખાં પઠાણ — કર્મ નં. ૪૪૮૬૮
૫.	એપેલેટ	શ્રી અજ્યકુમાર વી.જગતાપ —આસી.લો ઓફિસરશ્રી—૩૭૪૨૧
૬.	ઈજનેરી	શ્રી જે.પી.પરમાર — ડેપ્યુટી ઈજનેર —૩૬૨૨૭ શ્રી દિનેશભાઈ એમ.પટેલ—ડેપ્યુટી ઈજનેર—૧૨૪૮૦
૭.	આરોગ્ય સેનીટેશન	શ્રી સંજ્યકુમાર જગુભાઈ પટેલ—ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર—૧૪૪૦૩
	વી.બી.ડા.સી.	શ્રી જ્યસુખલાલ પી.વાગડીયા—ઈ.ચા.આસી.જંતુનાશક અધિકારીશ્રી—૩૪૨૬૪
	જન્મ મરણ લગ્ન નોંધણી	શ્રી શેખર પુડ્લીક નેકશીકર—સ્ટેટેસ્ટીકલ આસી.—૪૨૮૮૦

મુદ્રા નં. ૧૭:- અન્ય માહિતી સુરત મહાનગર પાલિકા જાહેર સત્તા મંડળ સાથે સંયુક્ત છે. અતે ના ખાતાની અલાયદી માહિતી નથી.

**માહિતી (મેળવવાના અધિકારી અધિનિયમ-૨૦૦૫
સાઉથઝોન-બી (કનકપુર)**

અ. નં.	ઝોન/ખાતા વિભાગનું નામ	જાહેર માહિતી અધિકારીનું નામ/કર્મચારી નં.	હોદ્દો	અપીલ અધિકારીનું નામ./કર્મ. નં. હોદ્દો
૧.	સાઉથઝોન-બી (કનકપુર) મહેકમ	શ્રી પી.કે.જરીવાલા -૧૨૨૬૩	ઈ.ચા.પર્સોનેલ ઓફિસર	ઈ.ચા.આસી.ભૂનિ.કમિશનરશ્રી પી.આર.પ્રસાદ-૩૪૮૩૫
	સાઉથઝોન-બી (કનકપુર) છિસાબી	શ્રી ભીખુભાઈ કે.પટેલ-૧૩૫૦૩	ડે.એકાઉન્ટન્ટ	ઈ.ચા.આસી.ભૂનિ.કમિશનરશ્રી પી.આર.પ્રસાદ-૩૪૮૩૫
	સાઉથઝોન-બી (કનકપુર) આકારણી અને સીવીક સેન્ટર	શ્રી ચેતન એસ.પાટીલ-૩૭૧૮૭	ઈ.ચા.એ.આર.ઓ.	ઈ.ચા.આસી.ભૂનિ.કમિશનરશ્રી પી.આર.પ્રસાદ-૩૪૮૩૫
	સાઉથઝોન-બી (કનકપુર) ગુમાસ્તાધારા	શ્રી નિતીન કે. ભાવસાર-૪૨૮૭૫	ગુમાસ્તાધારા ઈન્સ્પેક્ટર	ઈ.ચા.આસી.ભૂનિ.કમિશનરશ્રી પી.આર.પ્રસાદ-૩૪૮૩૫
	સાઉથઝોન-બી (કનકપુર) ગુમાસ્તાધારા	શ્રી મુસ્તુફારજાખાન અલ્લાહરખાં પઢાણ - કર્મ નં. ૪૪૮૬૮	ગુમાસ્તાધારા ઈન્સ્પેક્ટર	ઈ.ચા.આસી.ભૂનિ.કમિશનરશ્રી પી.આર.પ્રસાદ-૩૪૮૩૫
	સાઉથઝોન-બી (કનકપુર) કાયદા વિભાગ અને એપેલેટ વિભાગ	શ્રી અજયકુમાર વી.જગતાપ -૩૭૧૮૮	ઈ.ચા.આસી.લો. ઓફિસર	ઈ.ચા.આસી.ભૂનિ.કમિશનરશ્રી પી.આર.પ્રસાદ-૩૪૮૩૫
૨.	સાઉથઝોન-બી (કનકપુર) ઈજનેર વિભાગ	શ્રી જે.પી.પરમાર - ૩૬૨૨૭	ડે.ઇજનેર	કાર્યપાલક ઈજનેરશ્રી રાજેશભાઈ સી. જરીવાલા કર્મ નં. ૧૯૮૨૫
		શ્રી દિનેશભાઈ એમ. પટેલ -૧૨૪૮૦	ડે.ઇજનેર	કાર્યપાલક ઈજનેરશ્રી રાજેશભાઈ સી. જરીવાલા કર્મ નં. ૧૯૮૨૫
૩.	સાઉથઝોન-બી (કનકપુર) આરોગ્ય વિભાગ/આરોગ્ય સેન્ની.વિભાગ	શ્રી જયસુખલાલ પી.વાગડીયા -૩૪૨૬૪	ઈ.ચા.આસી. જતુનાશક અધિકારી	નાયબ આરોગ્ય અધિકારી શ્રી ડૉ. એ.પી.ભડ્ક (કર્મ. નં. ૧૭૨૪૦)